

ગુજરાત રાજ્યના શિક્ષણવિભાગના પગા-કમાંક
મશબ/1215/12-22/૭, તા. 1-3-2016 —થી મંજૂર

સંગીત

(તબલા)

ધોરણ 11

પ્રતિક્ષાપત્ર

ભારત મારો દેશ છે.
બધાં ભારતીયો મારાં ભાઈબહેન છે.
હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને
વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે.
હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ.
હું મારાં માતાપિતા, શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ
અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ.
હું મારા દેશ અને દેશબાંધવોને મારી નિષા અર્પું છું.
તેમના કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારું સુખ રહ્યું છે.

રાજ્ય સરકારની વિનામૂલ્યે યોજના હેઠળનું પુસ્તક



ગુજરાત રાજ્ય શાળા પાર્ટચિપુસ્તક મંડળ
'વિદ્યાયન', સેક્ટર 10-એ, ગાંધીનગર — 382010

© ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર

આ પાઠ્યપુસ્તકના સર્વ હક ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળને હસ્તક છે.
આ પાઠ્યપુસ્તકનો કોઈ પણ ભાગ કોઈ પણ રૂપમાં ગુજરાત રાજ્ય શાળા
પાઠ્યપુસ્તક મંડળના નિયામકની લેખિત પરવાનગી વગર પ્રકાશિત કરી શકાશે નહિ.

વિષય-સલાહકાર

શ્રી ભૂપેન્દ્રભાઈ એચ. શાહ

લેખન

શ્રી રમેશભાઈ જે. ભણ
કુ. સુભાંગીનીબહેન બી. મરાઠે
શ્રી સમ્યંકભાઈ આર. પારેખ
શ્રી મુંજાલભાઈ એસ. મહેતા

સમીક્ષા

શ્રી જીજેન ટિલાવત
શ્રી સંજય મહેતા

ભાષાશુદ્ધિ

ડૉ. પૂર્વી ઓજા

સંયોજન

ડૉ. કિઝા દવે
(વિષય-સંયોજક : અંગેજ)

નિર્માણ-આયોજન

શ્રી હરેન પી. શાહ
(નાયબ નિયામક : શૈક્ષણિક)

મુદ્રણ-આયોજન

શ્રી હરેશ એસ. લિંબાચિયા
(નાયબ નિયામક : શૈક્ષણિક)

પ્રસ્તાવના

રાષ્ટ્રીય અભ્યાસકમોના અનુસંધાનમાં ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે નવા અભ્યાસકમો તૈયાર કર્યા છે. આ અભ્યાસકમો ગુજરાત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે.

ગુજરાત સરકાર દ્વારા મંજૂર થયેલા ધોરણ 11, સંગીત (તથલા) વિષયના નવા અભ્યાસકમ અનુસાર તૈયાર કરવામાં આવેલું આ પાઠ્યપુસ્તક વિદ્યાર્થીઓ સમક્ષ મૂક્તાં મંડળ આનંદ અનુભવે છે.

આ પાઠ્યપુસ્તક પ્રસિદ્ધ કરતાં પહેલાં એની હસ્તપ્રતની આ સત્રે શિક્ષણકાર્ય કરતાં અને તજ્જો દ્વારા સર્વાંગી સમીક્ષા કરાવવામાં આવી છે. શિક્ષકો તથા તજ્જોનાં સૂચનો અનુસાર હસ્તપ્રતમાં યોગ્ય સુધારા-વધારા કર્યા પછી આ પાઠ્યપુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

પ્રસ્તુત પાઠ્યપુસ્તકને રસપ્રદ, ઉપયોગી અને ક્ષતિરહિત બનાવવા માટે મંડળે પૂરતી કાળજી લીધી છે. તેમ છતાં શિક્ષણમાં રસ ધરાવનાર વ્યક્તિઓ પાસેથી પુસ્તકની ગુણવત્તા વધારે તેવાં સૂચનો આવકાર્ય છે.

પી. ભારતી (IAS)

નિયામક
તા. 04-11-2019

કાર્યવાહક પ્રમુખ
ગાંધીનગર

પ્રથમ આવૃત્તિ : 2016 પુનર્મુદ્રણ : 2018, 2020

પ્રકાશક : ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, 'વિદ્યાયન', સેક્ટર ૧૦-એ, ગાંધીનગર વતી
પી. ભારતી, નિયામક

મુદ્રક :

મૂળભૂત ફરજો

ભારતના દરેક નાગરિકની ફરજ નીચે મુજબ રહેશે :*

- (ક) સંવિધાનને વફાદાર રહેવાની અને તેનાં આદર્શો અને સંસ્થાઓનો, રાષ્ટ્રધર્મનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની;
- (ખ) આજાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શોને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની;
- (ગ) ભારતનાં સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની;
- (ઘ) દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતાં, તેમ કરવાની;
- (ય) ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને, ભારતના તમામ લોકોમાં સુભેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવાની, સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજ દેવાની;
- (ઇ) આપણી સમજ્ઞિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજ તે જાળવી રાખવાની;
- (ઝ) જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પણુપંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકર્ષા રાખવાની;
- (ઝ) વૈજ્ઞાનિક માનસ, માનવતાવાદ તથા જિજ્ઞાસા અને સુધારણાની ભાવના કેળવવાની;
- (ટ) જાહેર ભિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની;
- (ઠ) રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિનાં વધુ ને વધુ ઉન્નત સોધાનો ભણી સતત પ્રગતિ કરતા રહી, વૈયક્તિક અને સામૂહિક પ્રવૃત્તિનાં તમામ ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવાની.
- (ડ) માતા-પિતાએ અથવા વાલીએ 6 થી 14 વર્ષ સુધીની વયના પોતાના બાળક અથવા પાલ્યને શિક્ષણની તકો પૂરી પાડવાની.

* ભારતનું સંવિધાન : કલમ 51-ક

અનુક્રમણિકા

વિભાગ 1 (સૈદ્હાંતિક)

1.	તાલ-પરિચય	1
2.	તાલ-વિસ્તાર	6
3.	પારિભાષિક શબ્દો	13
4.	વિવિધ ગાયનશૈલી	18
5.	તબલાના વર્ણ	21
6.	સાથ સંગત, સ્વતંત્ર તબલાવાદનની રીત, છંદ અને તાલની વિસ્તૃત નોંધ	27
7.	બોલોની નિકાસ	30
8.	જીવન-પરિચય	32

વિભાગ 2 (કિયાતમક)

1.	તાલ-પરિચય	36
2.	તાલ-ત્રિતાલ વાદન	41
3.	તાલ-એકતાલનું વાદન	46
4.	લગ્ની	49
5.	બોલ નિકાસ	51
6.	વાધ્ય વર્ગીકરણ	53
7.	સામાન્ય જ્ઞાન	54

શિક્ષકો માટે...

ધોરણ 11, સંગીતના અભ્યાસક્રમમાં...

- (1) સંગીત કંઈચ (ગાયન) અને સ્વરવાયના અભ્યાસક્રમ મુજબ આપેલ છે. જેમાંથી કિયાત્મકના એકમમાં આપેલ કંઈચના વિદ્યાર્થીઓને કંઈચના (ગાયન) અને સ્વરવાયના વિદ્યાર્થીઓને પોતાના સ્વરવાય પ્રમાણે કિયાત્મક (પ્રાયોગિક) આ સાથેના અભ્યાસક્રમ મુજબ તૈયારી કરાવવાની રહેશે.
- સૈદ્ધાંતિક વિષય કંઈચ (ગાયન) અને સ્વરવાયના વિદ્યાર્થીઓ માટે સમાન (એકસરખો) રહેશે.
- (2) સંગીત-તબલા અભ્યાસક્રમનું પુસ્તક અલગ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. તે પ્રમાણે તાલવાય (તબલા)ના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાનો રહેશે. જેમાં વિદ્યાર્થીઓએ અભ્યાસક્રમ મુજબ કિયાત્મક (પ્રાયોગિક) અને સૈદ્ધાંતિક (શાસ્ત્ર)ની તૈયારી કરાવવાની રહેશે.
- (3) સંગીત (કંઈચ) અને સંગીત (સ્વરવાય)ના વિદ્યાર્થીઓ માટે લેખિત પરીક્ષા ભાગ 1 રહેશે. જ્યારે સંગીત (તબલા)ના વિદ્યાર્થીઓ માટે ભાગ 2 રહેશે.
- (4) પ્રશ્નપત્રમાં ભાગ 1 અને ભાગ 2 છાપવામાં આવશે.
- (5) સંગીત કંઈચ, સ્વરવાય અને તબલાના અભ્યાસક્રમનું આયોજન વર્ગ દીઠ (પાંચ) ‘પાંચ’ તાસ (પિરિયડ)નું છે.
- (6) આ પુસ્તકમાં ‘વિભાગ 1’ સૈદ્ધાંતિક (શાસ્ત્ર)નો જ્યારે ‘વિભાગ 2’માં કિયાત્મક (પ્રાયોગિક)નો સમાવેશ કરવામાં આવ્યો છે. કંઈચ સંગીતના વિદ્યાર્થીઓને કિયાત્મક (પ્રાયોગિક)માં ગાયનની (ગાવાની) તાલીમ આપવાની રહેશે. જેમાં આ પાઈચપુસ્તકમાં આપેલ બંદિશો અને આલાપ-તાન શીખવાડવાના રહેશે.
- જ્યારે સ્વરવાયના વિદ્યાર્થીઓએ તેમણે પસંદ કરેલા સ્વરવાયની તૈયારી કરાવવાની રહેશે.
- સ્વરવાયના વિદ્યાર્થીઓએ નીચેના સ્વરવાયમાંથી ગમે તે એક સ્વરવાયનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
- (1) હાર્મોનિયમ (2) વાંસળી (3) સિતાર (4) સરોદ (5) વાયોલિન (6) ડિલર્બા (7) ગિટાર (8) મેન્ડોલિન
- આ સ્વરવાયોમાંથી ગમે તે એક સ્વરવાયમાં પાઈચપુસ્તક આધારિત ગતની તૈયારી કરાવવાની રહેશે.
- (7) આધુનિક સાધનોથી સજજ એવા અલગ સંગીત ખંડની જોગવાઈ હોવી ઈચ્છનીય છે. સંગીતના આધુનિક ઉપયોગી ઈલેક્ટ્રોનિક ઉપકરણો જેવા કે, સ્વરપેટી, તાનપુરો, તાલયંત્ર, ડિવીડી પ્લેયર, માઇકોફોન, ક્રિ-બોર્ડ, રેકોર્ડિંગ સિસ્ટમ, સીડી તેમજ વિવિધ તાલને લગતાં ઉપકરણો. સંગીત માટે આધુનિક સંગીતવિષયક લાયબ્રેરી અને અલાયદા વર્ગખંડની ભારતીય બેઠક સહિતની વ્યવસ્થા હોવી જરૂરી છે.
- (8) વિદ્યાર્થી ભવિષ્યમાં રંગમંચ પર પ્રસ્તુતિ તરફ દાખિ કેળવીને વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ કેળવાય, રિયાઝ દ્વારા નૈસર્જિક મધુર કંઈ કેળવાય, સ્વર, રાગ, તાલનું જ્ઞાન મેળવી વિદ્યાર્થી રંગમંચ પર સંગીતની પ્રસ્તુતિ કરવાનું કૌશલ્ય કેળવી શકે, તે આ પાઈચપુસ્તકનો ઉદ્દેશ છે.
- (9) વિદ્યાર્થી સંગીતની રસચેતનાનો અનુભવ કરે, આનંદ માણે, કદર કરે, તે ઉપરાંત પરંપરાગત લોકસંગીતના ઢાળ તેમજ સ્પષ્ટ ઉચ્ચારણો અને અવાજ કેળવે તથા શાસોશાસની વૈજ્ઞાનિક દાખિ અને બૌદ્ધિક સમજ કેળવે અને વિશેષ કરીને એ વિદ્યાર્થીઓની રચનાત્મક (કિએટિવ) શક્તિઓને યોગ્ય દિશાસૂચન મળે એ આ પાઈચપુસ્તકનો મુખ્ય હેતુ છે.
- (10) ધોરણ 11 તબલા વિષયની સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરીક્ષા શાળાક્ષાએ લેવાની રહેશે.



શિક્ષણનો અંતિમ ઉદ્દેશ માનવીના જ્ઞાન, ઉચ્ચતમ ભાવનાઓનો વિકાસ અને સંસ્કારોનું સિંચન કરવાનો છે. તદ્ધુપરાંત, સંગીતમાં તાલ પ્રત્યે અભિરુચિ કેળવાય, સંગીતમાં રસ ઉત્પન્ન થાય તે રીતે શિષ્ટ સંગીતની સમજ ધરાવતા સમાજનું નિર્માણ થાય, તે પણ છે.

સંગીતવિદ્યામાં તાલ એ સંગીતનો પ્રાણ છે. તાલ એ ગાયન, વાદન અને નૃત્યની સર્જનાત્મક કલાને જીવંત બનાવી, કલાકારની રંગમંચ પ્રસ્તુતિની સુંદરતામાં વધારો કરે છે અને રસજ્ઞ શ્રોતાઓના ચિત્તને પ્રસન્નતાથી ભરી દઈ આનંદ આપે છે. આવા તાલની સ્પષ્ટ અને વિસ્તૃત સમજ માટે વિદ્યાર્થી પ્રત્યક્ષ ગુરુ પાસે તાલીમ લઈ તાલના વિવિધ ઠેકા, માત્રા સાથે લયની સમજ સાથસંગત માટે કેળવે તે અત્યંત જરૂરી છે.

વહેતા સમયને લયથી બાંધવો એ તાલ. તાલ એ ગાયન, વાદન કે નૃત્યની કિયામાં પ્રાણ પૂરી ગીતને ગતિ આપે છે. ભારતીય તાલવાદોમાં ચામડાથી મહેલાં વાદો જેવા કે, પખવાજ, તબલા, ઢોલ, ઢોલક, નાલ વગેરેમાંથી નીકળતો વેરો અવાજ ગાયન-વાદનની કિયામાં ભળી જઈ કિયાને નિયંત્રિત કરી, કલાકારની કલ્પનાશક્તિમાં વધારો કરી, ઉત્સાહ વધારી શ્રોતાઓના મન-હદદ્યને આનંદિત કરે એવું ખાસ વાતાવરણ ઉત્પન્ન કરવાની તાકાત ધરાવે છે.

ભારતીય સંગીતમાં તાલ એક અને એના સ્વરૂપ અનેક છે. ગાયન, વાદન અને નૃત્યકિયાની આંટીઘૂંઠીમાં તાલ રચાય છે. તાલ રમે છે અને રમાડે છે. તાલમાં લયકારી ગણિત અને સમયના સૂક્ષ્મ ભાગની ગણતરી થાય છે. ભારતીય તાલની આ વિશેષતા છે. ભારતીય સંગીત સ્વરગ્રધાન છે જ્યારે વિદેશી સંગીત તાલપ્રધાન છે.

આ પુસ્તકમાં અવનદ્ય વાદ - તબલાનો પૂર્ણ પરિચય તથા તે વાદોને કેવી રીતે વગાડવા તેની રીત, તેના વિવિધ ગુણો અને અલગ-અલગ માત્રાઓ અને બોલથી બનતા તાલ કેવી રીતે વાગે તેની સરળ અને શાસ્ત્રીય માહિતી આપી સમજાવવામાં આવ્યું છે.

તબલાવાદનને સમજવા માટે લય, તાલ, સમ, ખાલી, કાયદા, ટુકડા, રેલા, પરન વગેરે પારિભાષિક શબ્દોનો પરિચય અહીં ઉદાહરણસહિત આપવામાં આવેલ છે.

વિદ્યાર્થીઓ તબલાવાદનની પ્રયોગલક્ષી પ્રવૃત્તિઓ વ્યક્તિગત અને સામૂહિક રીતે કરશે તેવી અપેક્ષા સહ.



વિભાગ 1 (સૈદ્ધાંતિક)

1

તાલ-પરિચય

પ્રસ્તાવના

સંગીતમાં સ્વર અને તાલ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. તબલાના વિદ્યાર્થીઓને અલગ અલગ માત્રાના તાલોની જાણકારી મેળવવી જરૂરી છે. જે આ એકમમાં જુદી જુદી માત્રાના તાલો દ્વારા જાણકારી પ્રાપ્ત થશે. તાલની જાણકારી સાથે સાથે એ તાલ કઈ ગાયન શૈલીમાં સંગત માટે ઉપયોગી થશે તેની વિશેષ જાણકારી આપવામાં આવી છે તેમજ દરેક તાલમાં આવતા બોલ દ્વારા ખબર પડશે કે આ તાલ ખુલ્લાબાજ એટલે કે પખાવજ પર વગાડવામાં આવે છે કે બંધબાજ એટલે કે તબલા પર વગાડવામાં આવે છે. આ બધી જ માહિતી આ એકમ દ્વારા મેળવી શકશો. તાલને અલગ અલગ લયમાં કેવી રીતે લખી શકાય તે જાણવું ખૂબ જ જરૂરી છે. એક માત્રામાં બે બોલ આવે તો દુશુન, ત્રણ બોલ આવે તો ત્રિશુન, ચાર બોલ આવે તો ચૌશુન લય થાય. તો એ લયમાં આખો તાલ કેવી રીતે લખવામાં આવશે તેની જાણકારી આ એકમથી મેળવી શકાશે. અને લયનું જ્ઞાન પ્રાપ્ત થશે.

(1) તાલ - એકતાલ

માહિતી :

આ તાલ ઘ્યાલ અંગની ગાયકીમાં સાથસંગત કરવા માટે ખૂબ પ્રચલિત તાલ છે. આ તાલની રૂચના ઘ્યાલ અંગની ગાયકીના જન્મ સાથે થઈ હશે. આ તાલને વિલંબિતલય, મધ્યલય તથા દૃતલય આ ગ્રંથે લયમાં ખૂબ જ સુંદરતાથી વગાડી શકાય છે. આ તાલમાં પેશકાર, કાયદા, ટુકડા, રેલા, પરન વગેરે વગાડી શકાય છે. આ તાલ સોલોવાદન અને સંગતમાં ઉપયોગી તાલ છે. આ તાલ બંધબાજમાં વગાડવામાં આવે છે.

માત્રા-12, વિભાગ-6, તાલી-1, 5, 9, 11 માત્રા પર, ખાલી-3, 7 માત્રા પર.

મૂળ લય :

1	2	3	4	5	6	7	8	9	10	11	12	1
ધી	ધી	ધાગે	તિરકિટ	તું	ના	ક	તા	ધાગે	તિરકિટ	ધી	ના	ધી
X		0		2		0		3		4		X

દુશુન લય :

1	2	3	4	5	6	7	8	9	10	11	12	1
ધીધી	ધાગે	તિરકિટ	તુંના	કતા	ધાગેતિરકિટ	ધીના	ધીધી	ધાગેતિરકિટ	તુંના	કતા	ધાગેતિરકિટ	ધીના
X		0		2		0		3		4		X

ચૌગુન લય :

1 धીધીધાગેતિરકિટ X	2 તૂના કતા	3 ધાગેતિરકિટધીના	4 ધીધીધાગેતિરકિટ	5 તૂનાકતા	6 ધાગેતિરકિટધીના	
7 ધીધીધાગેતિરકિટ 0	8 તૂના કતા	9 ધાગેતિરકિટધીના	10 ધીધીધાગેતિરકિટ	11 તૂનાકતા	12 ધાગેતિરકિટધીના	ધા
		3		4		X

(2) તાલ-રૂપક

માહિતી :

આ તાલનો ઉપયોગ સોલોવાદનમાં જ્યાલ અંગની ગાયકીમાં તથા વાદ સંગીત જેવા કે સિતાર, વાયોલિન વગેરેની ગતોમાં સંગત કરવામાં થાય છે. આજકાલ ભજનસંગીત, ગઝલ તેમજ ભાવસંગીત જેવા પ્રકારોમાં સંગત કરવામાં ઉપયોગ તાલ માનવામાં આવે છે. સોલોવાદનમાં પેશકાર, કાયદા, ટુકડા, રેલા, પરન વગેરે આ તાલમાં વગાડવામાં આવે છે. આ તાલમાં શાસ્ત્રના નિયમ પ્રમાણે ખાલી આવતી નથી પરંતુ કિયાત્મક દણિથી આ તાલની શરૂઆત “તી” શબ્દથી થાય છે એટલે લોકો મોટે ભાગે ખાલી માને છે એટલે આ તાલની પહેલી માત્રા પર તાલી અને ખાલી બંનેના ચિહ્નન કરવામાં આવે છે.

મૂળ લય :

માત્રા-7, વિભાગ-3, તાલી : 1, 4, 6 માત્રા પર.

1 તી ⊗	2 તી ⊗	3 ના	4 ધી 2	5 ના	6 ધી 3	7 ના	1 તી ⊗
--------------	--------------	---------	--------------	---------	--------------	---------	--------------

દુગુન લય :

1 તીતી ⊗	2 નાધી ⊗	3 નાધી ⊗	4 ના,તી 2	5 તીના 3	6 ધીના 3	7 ધીના ⊗	1 તી ⊗
----------------	----------------	----------------	-----------------	----------------	----------------	----------------	--------------

ચૌગુન લય :

1 તીતીનાધી ⊗	2 નાધીનાતી ⊗	3 તીનાધીના	4 ધીના,તીતી 2	5 નાધીનાધી 3	6 નાતીતીના 3	7 ધીનાધીના	1 તી ⊗
--------------------	--------------------	---------------	---------------------	--------------------	--------------------	---------------	--------------

નોંધ : આ તાલ બંધબાજમાં વગાડવામાં આવે છે.

(3) તાલ-ચૌતાલ

માહિતી :

ચારતાલ અથવા ચૌતાલ પખાવજ વાધનો મુખ્ય તાલ માનવામાં આવે છે. આ તાલનો ઉપયોગ દ્યુપદ અંગની ગાયકીમાં સંગત માટે કરવામાં આવે છે. આ તાલનાં તાલી, ખાલી તથા વિભાગ એકતાલની જેમ સરખા છે. આ તાલમાં પખાવજ પર સોલોવાદન પણ કરવામાં આવે છે. આ તાલના બોલ ખુલ્લા અને જોરદાર છે. આ તાલમાં પરન, રેલા, તિહાઈ વગેરે વગાડવામાં આવે છે.

માત્રા-12, વિભાગ-6, તાલી-1, 5, 9, 11 માત્રા પર, ખાલી-3, 7 માત્રા પર.

મૂળ લય :

1	2	3	4	5	6	7	8	9	10	11	12	1
ધા	ધા	દિ	તા	કિટ	ધા	દિ	તા	તિટ	કિતા	ગાદિ	ગન	ધા
X		0		2		0		3		4		X

દુગુન લય :

1	2	3	4	5	6	7	8	9	10	11	12	1
ધાધા	દિંતા	કિટધા	દિંતા	તિટકતા	ગાદિગન	ધાધા	દિંતા	કિટધા	દિંતા	તિટકતા	ગાદિગન	ધા
X		0		2		0		3		4		X

ચૌગુન લય :

1	2	3	4	5	6	
ધાધાદિંતા	કિટધાદિંતા	તિટકતાગાદિગન	ધાધાદિંતા	કિટધાદિંતા	તિટકતાગાદિગન	
X		0		2		
7	8	9	10	11	12	
ધાધાદિંતા	કિટધાદિંતા	તિટકતાગાદિગન	ધાધાદિંતા	કિટધાદિંતા	તિટકતાગાદિગન	
0		3		4		

(4) તાલ-દીપચંદી

માહિતી :

આ તાલનો ઉપયોગ હુમરી ગાયન તથા હોરી, ચૈતી, કજરી વગેરે ગાયનપ્રકારોમાં સંગત માટે કરવામાં આવે છે. આ તાલમાં સોલોવાદન કરવામાં આવતું નથી એટલે આ તાલમાં પેશકાર, કાયદા, પરન વગેરે વગાડવામાં આવતા નથી પરંતુ નાના-નાના બોલોના મોહરા, મુખડાનો જ ક્યારેક ઉપયોગ કરવામાં આવે છે. આ તાલ બંધભાજનો તાલ છે.

માત્ર-14, વિભાગ-4, તાલી-1, 4, 11 માત્રા ૫૨, ખાલી-8 માત્રા ૫૨.

મૂળ લય :

1	2	3	4	5	6	7	8	9	10	11	12	13	14	1
ધા	ધી	ઝ	ધા	ધા	તી	ઝ	તા	તિ	ઝ	ધા	ધા	ધી	ઝ	ધા
X			2				0			3				X

હુગુન લય :

1	2	3	4	5	6	7	8	9	10	11	12	13	14	1
ધાધી	ઝધા	ધાતી	કતા	તીઝ	ધાધા	ધીઝ	ધાધી	કધા	ધાતી	કતા	તીઝ	ધાધા	ધીઝ	ધા
X			2				0			3				X

● ચૌગુન લય :

1	2	3	4	5	6	7	
ધાધીકધા	ધાતીકતા	તીઝધાધા	ધીઝધાધી	કધાધાતી	કતાતીઝ	ધાધાધીઝ	
X			2				
8	9	10	11	12	13	14	1
ધાધીકધા	ધાતીકતા	તીઝધાધા	ધીઝ, ધાધી	કધાધાતી	કતાતીઝ	ધાધાધીઝ	ધા
0			3				X

સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો :

- (1) તાલ એકતાલનો ઉપયોગ કઈ ગાયકીમાં વધુ થાય છે ?
- (2) તાલ એકતાલમાં કેટલી તાલી અને કેટલી ખાલી આવે છે ?
- (3) તાલ રૂપકમાં બે-બે માત્રાના કેટલા વિભાગ છે ?
- (4) તાલ ચૌતાલને ક્યા વાદ પર વગાડવામાં આવે છે ?
- (5) તાલ ચૌતાલ ક્યા બાજમાં વગાડવામાં આવે છે ?
- (6) તાલ દીપચંદીની કેટલી માત્રા છે ?

(7) તાલ દીપંદીનો ઉપયોગ કઈ ગાયકીમાં વહુ થાય છે ?

(8) ખુલ્લા બાજમાં કયો તાલ વગાડવામાં આવે છે ?

(9) તાલ રૂપક કયા બાજમાં વગાડવામાં આવે છે ?

2. સાચા જવાબ સામે ✓ ટીક કરો :

(1) તાલ એકતાલને કયા બાજમાં વગાડવામાં આવે છે ?

(A) બંધ બાજ (B) ખુલ્લા બાજ (C) નૃત્ય બાજ (D) લોકસંગીત બાજ

(2) તાલ રૂપકને કયા વાદ્ય પર વગાડવામાં આવે છે ?

(A) પખાવજ (B) ઢોલ (C) નાળ (D) તબલા

(3) તાલ ચૌતાલનો ઉપયોગ કઈ ગાયકીમાં વહુ થાય છે ?

(A) ધમાર (B) હુમરી (C) શુપદ (D) તરાના

(4) તાલ ચૌતાલમાં કેટલી તાલી આવે છે ?

(A) બે (B) ચાર (C) એક (D) ત્રણ

(5) તાલ દીપંદીમાં ખાલી કઈ માત્રા પર આવે છે ?

(A) ચાર (B) એક (C) આઠ (D) અંગ્રીયાર



આ એકમ દ્વારા વિદ્યાર્થીઓને કિયાત્મક અભ્યાસક્રમમાં આવતા વિવિધ તાલો જેવા કે એકતાલ, રૂપક, ચૌતાલ, દીપચંદી આ તાલોમાં કાયદા, પલ્ટા, તિહાઈ, ટુકડા, રેલા, ચકધાર વગેરે પ્રકારોને તાલના ખંડ પ્રમાણે કેવી રીતે લખવા તેનું જ્ઞાન પ્રાપ્ત થશે. એટલે તાલના ખંડમાં રહીને ચકધાર કે ટુકડા બનાવવાનો પણ અભ્યાસ થશે.

સૈદ્ધાંતિક

(1) તાલ - રૂપક, માત્રા - 7

કાયદો

<u>ધાગેતિટ</u>	<u>ધાગેતિરકિટ</u>	<u>ધિનાગીના</u>	<u>ધાડતીરકિટ</u>	<u>ધાતીરકિટધા</u>	<u>ગેનાધાગે</u>	<u>તિનાકિના</u>	
<u>⊗</u>			<u>2</u>		<u>3</u>		
<u>તાગેતિટ</u>	<u>તાકેતિરકિટ</u>	<u>તિનાકિના</u>	<u>ધાડતીરકિટ</u>	<u>ધાતીરકિટધા</u>	<u>ગેનાધાગે</u>	<u>ધિનાગીના</u>	<u>તા</u>
<u>⊗</u>			<u>2</u>		<u>3</u>		<u>0</u>

પદ્ધતા-1

<u>ધાગેતિટ</u>	<u>ધાગેતિરકિટ</u>	<u>ધિનાગીના</u>	<u>ધાધાતીરકિટ</u>	<u>ધાતીરકિટધા</u>	<u>ગેનાધાગે</u>	<u>તિનાકિના</u>	
<u>⊗</u>			<u>2</u>		<u>3</u>		
<u>તાકેતિટ</u>	<u>તાકેતિરકિટ</u>	<u>તિનાકિના</u>	<u>ધાધાતીરકિટ</u>	<u>ધાતીરકિટધા</u>	<u>ગેનાધાગે</u>	<u>ધિનાગીના</u>	
<u>⊗</u>			<u>2</u>		<u>3</u>		

પદ્ધતા-2

<u>ધાગેતિટ</u>	<u>ધાગેતિટ</u>	<u>ધાગેતિરકિટ</u>	<u>ધિનાગીના</u>	<u>ધાતીરકિટધા</u>	<u>ગેનાધાગે</u>	<u>તિનાકિના</u>	
<u>⊗</u>			<u>2</u>		<u>3</u>		
<u>તાકેતિટ</u>	<u>તાકેતિટ</u>	<u>તાકેતિરકિટ</u>	<u>ધિનાગીના</u>	<u>ધાતીરકિટધા</u>	<u>ગેનાધાગે</u>	<u>ધિનાગીના</u>	
<u>⊗</u>			<u>2</u>		<u>3</u>		

પદ્ધતા-3

<u>ધાગેતિટ</u>	<u>ધાગેતિરકિટ</u>	<u>ધિનાગીના</u>	<u>ધાગેતિટ</u>	<u>ધાતીરકિટધા</u>	<u>ગેનાધાગે</u>	<u>તિનાકિના</u>	
<u>⊗</u>			<u>2</u>		<u>3</u>		
<u>તાકેતિટ</u>	<u>તાકેતિરકિટ</u>	<u>તિનાકિના</u>	<u>ધાગેતિટ</u>	<u>ધાતીરકિટધા</u>	<u>ગેનાધાગે</u>	<u>ધિનાગીના</u>	
<u>⊗</u>			<u>2</u>		<u>3</u>		

તिहाई

<u>धारेतिट</u>	<u>धारेतिरकिट</u>	<u>धिनागीना</u>	<u>धाडतीડ</u>	<u>धाडडड</u>	<u>धारेतिट</u>	<u>धारेतिरकिट</u>	
<u>⊗</u>			<u>2</u>		<u>3</u>		
<u>धिनागीना</u>	<u>धाडतीડ</u>	<u>धाडडड</u>	<u>धारेतिट</u>	<u>धारेतिरकिट</u>	<u>धिनागीना</u>	<u>धाडतीડ</u>	<u>ती</u>
<u>⊗</u>			<u>2</u>		<u>3</u>		<u>0</u>

टुकडा

<u>षिटघिट</u>	<u>धारेतिट</u>	<u>कधेतिट</u>	<u>धारेतिट</u>	<u>कतिटत</u>	<u>गेनधित</u>	<u>धारेतिट</u>	
<u>⊗</u>			<u>2</u>		<u>3</u>		
<u>तर्गेडन्न</u>	<u>धाडताड</u>	<u>धाडतोे</u>	<u>उन्धा</u>	<u>ताडधाड</u>	<u>तर्गेडन्न</u>	<u>धाडताड</u>	<u>ती</u>
<u>⊗</u>			<u>2</u>		<u>3</u>		<u>0</u>

रेला

<u>धाडतिर</u>	<u>किटतक</u>	<u>तिरकिट</u>	<u>धाडतिर</u>	<u>किटतक</u>	<u>ताडतिर</u>	<u>किटतक</u>	
<u>⊗</u>			<u>2</u>		<u>3</u>		
<u>ताडतिर</u>	<u>किटतक</u>	<u>तिरकिट</u>	<u>धाडतिर</u>	<u>किटतक</u>	<u>धाडतिर</u>	<u>किटतक</u>	<u>ति</u>
<u>⊗</u>			<u>2</u>		<u>3</u>		<u>0</u>

चकधार परन

<u>तिरकिटधेतू</u>	<u>तिरकिटधेतू</u>	<u>तर्गेडन्न</u>	<u>धाडताड</u>	<u>धाडतिड</u>	<u>धडडन्न</u>	<u>ताडधाड</u>	
<u>⊗</u>			<u>2</u>		<u>3</u>		
<u>धाडकिटतक</u>	<u>धातीरेना</u>	<u>धातीरेना</u>	<u>धाडडड</u>	<u>तकधिडाडन</u>	<u>धाधीना</u>	<u>धातीना</u>	
<u>⊗</u>			<u>2</u>		<u>3</u>		
<u>धाडडड</u>	<u>तकधिडाडन</u>	<u>धाधीना</u>	<u>धातीना</u>	<u>धाडडड</u>	<u>तकधिडाडन</u>	<u>धाधीना</u>	
<u>⊗</u>			<u>2</u>		<u>3</u>		
<u>धातीना</u>	<u>धाडडड</u>	<u>उउउ</u>	<u>तिरकिटधेतू</u>	<u>तिरकिटधेतू</u>	<u>तर्गेडन्न</u>	<u>धाडताड</u>	
<u>⊗</u>			<u>2</u>		<u>3</u>		
<u>धाडतिड</u>	<u>धडडन्न</u>	<u>ताडधाड</u>	<u>धाडकिटतक</u>	<u>धातीरेन</u>	<u>धातीरेन</u>	<u>धाडडड</u>	
<u>⊗</u>			<u>2</u>		<u>3</u>		
<u>तकधिडाडन</u>	<u>धाधीना</u>	<u>धातीना</u>	<u>धाडडड</u>	<u>तकधिडाडन</u>	<u>धाधीना</u>	<u>धातीना</u>	
<u>⊗</u>			<u>2</u>		<u>3</u>		
<u>धाडडड</u>	<u>तकधिडाडन</u>	<u>धाधीना</u>	<u>धातीना</u>	<u>धाडडड</u>	<u>उउउ</u>	<u>तिरकिटधेतू</u>	
<u>⊗</u>			<u>2</u>		<u>3</u>		

<u>तिरक्किटधेत्</u> ⊗	<u>तजेऽन्न</u>	<u>धाऽताद</u>	<u>धाऽतिः</u> 2	<u>धृत्तन्न</u>	<u>ताऽधाऽ</u> 3	<u>धाऽक्किटत्तक</u>	
<u>धातिगेना</u> ⊗	<u>धातिगेना</u>	<u>धाऽत्त</u>	<u>तक्षिडाऽन</u> 2	<u>धाधीना</u>	<u>धातीना</u> 3	<u>धाऽत्त</u>	
<u>तक्षिडाऽन</u> ⊗	<u>धाधीना</u>	<u>धातीना</u>	<u>धाऽत्त</u> 2	<u>तक्षिडाऽन</u>	<u>धाधीना</u> 3	<u>धातीना</u>	ति 0

(2) તાલ-એકતાલ માત્રા-12

કાયદો

<u>धાગેતિટ</u> X	<u>धાગેતિરકિટ</u>	<u>ધિંનાગીના</u> 0	<u>धાગેનધા</u>	<u>તિટધાગે</u> 2	<u>તિંનાકિના</u>	
<u>તાકેતિટ</u> 0	<u>તાકેતિરકિટ</u>	<u>તિંનાકિના</u> 3	<u>धાગેનધા</u>	<u>તિટધાગે</u> 4	<u>ધિંનાગીના</u>	ধી X

પદ્ધતો-1

<u>धાગેતિટ</u> X	<u>તિટધાગે</u>	<u>ધિંનાગીના</u> 0	<u>धાગેનધા</u>	<u>તિટધાગે</u> 2	<u>ધિંનાગીના</u>	
<u>धાગેતિટ</u> 0	<u>धાગેતિરકિટ</u>	<u>ધિંનાગીના</u> 3	<u>धાગેનધા</u>	<u>તિટધાગે</u> 4	<u>તિંનાકિના</u>	
<u>તાકેતિટ</u> X	<u>તિટતાકે</u>	<u>તિંનાકિના</u> 0	<u>તાકેનતા</u>	<u>તિટતાકે</u> 2	<u>તિંનાકિના</u>	
<u>धાગેતિટ</u> 0	<u>धાગેતિરકિટ</u>	<u>ધિંનાગીના</u> 3	<u>धાગેનધા</u>	<u>તિટધાગે</u> 4	<u>ધિંનાગીના</u>	

પદ્ધતો-2

<u>धાગેનધા</u> X	<u>તિટધાગે</u>	<u>ધિંનાગીના</u> 0	<u>धાગેનધા</u>	<u>તિટધાગે</u> 2	<u>ધીંનાગીના</u>	
<u>धાગેતિટ</u> 0	<u>ধાગેતિરકિટ</u>	<u>ધિંનાગીના</u> 3	<u>ধાગેનધા</u>	<u>તિટધાગે</u> 4	<u>તિંનાકિના</u>	
<u>તાકેનતા</u> X	<u>તિટતાકે</u>	<u>તિંનાકિના</u> 0	<u>તાકેનતા</u>	<u>તિટતાકે</u> 2	<u>તિંનાકિના</u>	
<u>ধાગેતિટ</u> 0	<u>ধાગેતિરકિટ</u>	<u>ધિંનાગીના</u> 3	<u>ধાગેનધા</u>	<u>તિટધાગે</u> 4	<u>ધિંનાગીના</u>	

પદ્ધતો-3

<u>ધારેતિટ</u>	<u>ડડધાગે</u>	<u>ધિનાગીના</u>	<u>ધારેનધા</u>	<u>તિટધાગે</u>	<u>ધિનાગીના</u>
X		0		2	
<u>ધારેતિટ</u>	<u>ધારેતિરકિટ</u>	<u>ધિનાગીના</u>	<u>ધારેનધા</u>	<u>તિટધાગે</u>	<u>તિનાકિના</u>
0		3		4	
<u>તાકેતિટ</u>	<u>ડડતાકે</u>	<u>તિનાકિના</u>	<u>તાકેનતા</u>	<u>તિટતાકે</u>	<u>તિનાકિના</u>
X		0		2	
<u>ધારેતિટ</u>	<u>ધારેતિરકિટ</u>	<u>ધિનાગીના</u>	<u>ધારેનધા</u>	<u>તિટધાગે</u>	<u>ધિનાગીના</u>
0		3		4	

તિહાઈ

<u>ધારેતિટ</u>	<u>ધારેતિરકિટ</u>	<u>ધિનાગીના</u>	<u>ધાડડડ</u>	<u>ડડધાગે</u>	<u>તિટધાગે</u>
X		0		2	
<u>તિરકિટધીના</u>	<u>ગીનાધાડ</u>	<u>ડડડડ</u>	<u>ધારેતિટ</u>	<u>ધારેતિરકિટ</u>	<u>ધિનાગીના</u>
0		3		4	

દુક્કા

<u>દિંતિર</u>	<u>કિટતક</u>	<u>નાતિર</u>	<u>કિટતક</u>	<u>તિંતિર</u>	<u>કિટતક</u>
X		0		2	
<u>તાતિર</u>	<u>કિટતક</u>	<u>ધિરધિર</u>	<u>કિટતક</u>	<u>તિરકિટ</u>	<u>તકતાડ</u>
0		3		4	
<u>તિરકિટ</u>	<u>ધાડતીડ</u>	<u>ધાડડડ</u>	<u>તિરકિટ</u>	<u>તકતા</u>	<u>તિરકિટ</u>
X		0		2	
<u>ધાડતીડ</u>	<u>ધાડડડ</u>	<u>તિરકિટ</u>	<u>તકતા</u>	<u>તિરકિટ</u>	<u>ધાડતીડ</u>
0		3		4	

રેલા

<u>ધાડતિર</u>	<u>ઘિડનગ</u>	<u>તિરકિટ</u>	<u>ધિરધિર</u>	<u>ઘિડનગ</u>	<u>તિરકિટ</u>
X		0		2	
<u>તાડતિર</u>	<u>કિડનગ</u>	<u>તિરકિટ</u>	<u>ધિરધિર</u>	<u>ઘિડનગ</u>	<u>તિરકિટ</u>
0		3		4	

ચક્કધાર પરન

કટકષિ	કિટધારે	તિટકતા	ગાદિગન	ધાડતીડ	ધાડગેના	
X		0		2		
ધડના	તાડધાડ	કિટતકતિરકિટ	તકતકતિરકિટ	ધાડતીડ	ધાડગેના	
0		3		4		
ધડડડ	ધાડતીડ	ધાડગેના	ધડડડ	ધાડતીડ	ધાડગેના	
X		0		2		
ધડડ	૩૩૩૩	૩૩૩૩	કટકષિ	કિટધારે	તિટકતા	
0		3		4		
ગાદિગન	ધાડતીડ	ધાડગેના	ધડના	તાડધાડ	કિટતકતિરકિટ	
X		0		2		
તકતકતિરકિટ	ધાડતીડ	ધાડગેના	ધડડડ	ધાડતીડ	ધાડગેના	
0		3		4		
ધડડડ	ધાડતીડ	ધાડગેના	ધડડડ	૩૩૩૩	૩૩૩૩	
X		0		2		
કટકષિ	કિટધારે	તિટકતા	ગાદિગન	ધાડતીડ	ધાડગેના	
0		3		4		
ધડના	તાડધાડ	કિટતકતિરકિટ	તકતકતિરકિટ	ધાડતીડ	ધાડગેના	
X		0		2		
ધડડડ	ધાડતીડ	ધાડગેના	ધડડડ	ધાડતીડ	ધાડગેના	ધી
0		3		4		X

(3) તાલ-ચૌતાલ-માત્ર-12

તિહાઈ

તિટકત	ગાદિગન	ધડડડ	૩૩૩૩	૩૩૩૩	તિટકત
X		0		2	
ગાદિગન	ધડડડ	૩૩૩૩	૩૩૩૩	તિટકત	ગાદિગન
0		3		4	

● ટુકડો

તિરકિટ	ધડતૂડ	તિરકિટ	ધડતૂડ	ધિટ	ધિટ	
X		0		2		
ધાગે	તિટ	ક્ષા	તિટ	ધાગે	તિટ	
0		3		4		
ગાણ	ગન	નાગે	તિટ	ગાણ	ગન	
X		0		2		
ધા	ગાણ	ગન	ધા	ગાણ	ગન	ધા
0		3		4		X

પરન

ધાડકિટ	તકધૂમ	કિટતક	ધિડતા	કિટધેડ	ડધા	
X		0		2		
તિરકતા	ગાણગન	ધાડાડ	ડડતા	ધાડકિટ	ધિડતાડ	
0		3		4		
ધાડધૂમ	કિટતક	ધાડતાડ	ધાડકિટ	ધિડતાડ	ધાડધૂમ	
X		0		2		
કિટતક	ધાડતાડ	ધાડકિટ	ધિડતાડ	ધાડધૂમ	કિટતક	ધા
0		3		4		X

રેલા

ધાડકિટ	તકધૂમ	કિટતક	ધૂમકિટ	તકધાડ	કિટતક	
X		0		2		
તાડકિટ	તકધૂમ	કિટતક	ધૂમકિટ	તકધાડ	કિટતક	ધા
0		3		4		X

(4) તાલા:- દિપચંદી, માત્રા-14

આ તાલનો ઉપયોગ હુમરી અંગમાં થતો હોવાથી એમાં કાયદા પદ્ધતા વગાડવામાં આવતા નથી પરંતુ આ તાલમાં રેલા, લળી વગાડવામાં આવે છે.

રેલા

ધા	ધિડનગ	તિરકિટ	ધાડતિર	કિટતક	તાડતિર	કિટતક	
X			2				
તા	કિડનગ	તિરકિટ	ધાડતિર	કિટતક	ધાડતિર	કિટતક	ધા
0			3				X

લગ્ની

(1)	ધા	ધિંના	ગિના		ધા	ધા	ધિંના	ગિના	
	X				2				
	તા	તિંના	કિના		ધા	ધા	ધિંના	ગિના	ધા
	0				3				X
(2)	ધાતી	ધાધા	તિના		ધાતિ	ધાતિ	ધાધા	તિના	
	X				2				
	તાતી	તાતા	તિના		ધાતિ	ધાતિ	ધાધા	ધિંના	ધા
	0				3				X

સ્વાધ્યાય

1. ટૂંકમાં જવાબ આપો :

- (1) તાલ એકતાલની કેટલી માત્રા છે ?
- (2) તાલ રૂપકના કેટલા વિભાગ છે ?
- (3) તાલ ચૌતાલ ક્યા વાદ્ય પર વગાડવામાં આવે છે ?
- (4) તાલ ટિપચંદીમાં કેટલા વિભાગ છે ?

2. સાચા જવાબ સામે ✓ ટીક કરો :

- (1) તાલ એકતાલ કઈ ગાયન શૈલીમાં વધુ ઉપયોગી છે ?
 - (A) હુમરી
 - (B) ધમાર
 - (C) શુપદ
 - (D) ઝાલ
- (2) તાલ રૂપકને ક્યા વાદ્ય પર વગાડવામાં આવે છે ?
 - (A) ટોલક
 - (B) અર્મર
 - (C) તબલા
 - (D) પખાવજ
- (3) તાલ ચૌતાલ ક્યા બાજનો તાલ છે ?
 - (A) ખુલ્લાબાજ
 - (B) બંધબાજ
- (4) તાલ ટિપચંદીમાં શું વગાડવામાં આવે છે ?
 - (A) તિહાઈ
 - (B) લગ્ની
 - (C) પરન
 - (D) ટુકડા



પ્રસ્તાવના

પારિભાષિક શબ્દોની વ્યાખ્યા અંતર્ગત આ એકમમાં ગત, પરન, ચક્ધાર, ત્રિપલ્લી, ચૌપલ્લી, મુખડા, મોહરા, લગ્ની, નૌહક્કા જેવા તબલાવાદન કલાને લગતા વિવિધ શબ્દોની સમજ ઉદાહરણ સાથે આપવામાં આવી છે. કોઈ પણ વિદ્યાર્થી આ શબ્દો ના જ્ઞાણો તો તબલાવાદન કલા વિકસાવી ના શકે. ભજન, ગંગલ કે સુગમસંગીત સાથે સંગત કરતા કલાકારો સારામાં સારી સંગત કરી શકે પરંતુ તબલાવાદન કલાની વિદ્યા હાંસલ કરવા આ શબ્દો તથા શબ્દ મુજબની રચનાની જાણકારી આવશ્યક છે. આ એકમમાં તે જાણાવવાનો પ્રયાસ કરેલ છે.

પારિભાષિક શબ્દોની વ્યાખ્યા :

(1) ગત : ‘ગત’નો ઉપયોગ સ્વતંત્ર તબલાવાદનમાં ખૂબ જ થાય છે. અલગ-અલગ પ્રકારનાં બોલસમૂહને ભેગા કરી અને એકવાર ‘ભરી’ તથા બીજી વખત ખાલીથી વગાડવામાં આવે છે. ગત તિહાઈ સાથે અથવા તો તિહાઈ વગરની હોય છે અને તેના પ્રસ્તારની સંભાવનાં ખૂબ ઓછી હોય છે. જુદા જુદા ઘરાનામાં જુદા જુદા પ્રકારની ગત હોય છે અને તેની વિશેષતા પણ અલગ હોય છે. ગતોના નામ પણ અલગ અલગ હોય છે.

ઉદાહરણો : દુપલ્લી ગત, ત્રિપલ્લી ગત, ચૌપલ્લી ગત, દર્જેની ગત, દુધારી ગત, તીધારી ગત વગેરે.

ઉદાહરણો : ગત ત્રિતાલ (ફરૂખાબાદ ઘરાના)

ધાતીધાડ	ધાતીગીન	ધીનાગીના	ધાતીધાડ
X			
કડધેતથે 2	તેટગીન	ધાતીગીન	ધીનાગીના
તા-કીટતક 0	તા-કીટતક	તાતીરકીટતક	તાતીરકીટતક
તીરકીટકતા 3	તીરકીટધાતી	ધાગેનધા	તીધાગેન
તાતીતાડ X	તાતાકીન	તીનાકીના	તાતીતાડ
કડતેતૂતે 2	તેટ કીન	તાતીકીન	તીનાકીના
તાડકીટતક 0	તાડકીટતક	ધાતીરકીટતક	ધાતીરકીટતક
તીરકીટતકતા 3	તીરકીટધાતી	ધાગેનધા	તીધાગેન
			ધા
			X

(2) પરન : પરન શબ્દ પખાવજ સાથે સંકળાયેલો છે. પરનમાં મુખ્યત્વે જોરદાર ખુલ્લા બોલોનો સમાવેશ હોય છે. પરનની ખાસિયતમાં એક તો તેના બોલો જોડીમાં વાગતા જેવા મળે છે અને તિહાઈ સાથેની આ રચના દ્વાત લયમાં વધુ સુંદર લાગે છે. તેની રચનામાં મુખ્યત્વે ધેતથેત, ધાગેતીટ તાગેતિટ, કડધેતીટ વગેરે ખુલ્લા બોલ જેવા મળે છે.

ઉદાહરણ : તાલ-ત્રિતાલમાં પરન

<u>ધીટથીટ</u>	<u>ધાગેતીટ</u>	<u>કડધેતીટ</u>	<u>ધાગેતીટ</u>	
X				
<u>કડધેતીટ</u>	<u>કડધેતીટ</u>	<u>કડધેતીટ</u>	<u>ધાગેતીટ</u>	
2				
<u>કડધેતીટ</u>	<u>ધાગેતીટ</u>	ધા	<u>કડધેતીટ</u>	
0				
<u>ધાગેતીટ</u>	ધા	<u>કડધેતીટ</u>	<u>ધાગેતીટ</u>	
3				
				ધા
				X

(3) ચકધાર : ચોક્કસ બોલસમૂહની રચના જે તિહાઈ સાથે રજૂ કરતાં સમ ઉપર અંતિમ “ધા” આવે આવી રચનાને ચકધાર કહેવામાં આવે છે.

ચકધારનાં ત્રણ પ્રકાર હોય છે : (1) સાઢી ચકધાર (2) ફરમાયશી ચકધાર (3) કમાલી ચકધાર.

તાલ-ત્રિતાલમાં “સાઢી ચકધાર”

<u>ધાડધાડ</u>	<u>દીડદીડ</u>	<u>નાડનાડ</u>	<u>તીટતીટ</u>	
X				
<u>કતીટધા</u>	<u>તીટકત</u>	<u>કતીટધા</u>	<u>તીટકત</u>	
2				
<u>કતીટધા</u>	<u>તીટકત</u>	ધા	<u>ધાડધાડ</u>	
0				
<u>દીડદીડ</u>	<u>નાડનાડ</u>	<u>તીટતીટ</u>	<u>કતીટધા</u>	
3				
<u>તીટકત</u>	<u>કતીટધા</u>	<u>તીટકત</u>	<u>કતીટધા</u>	
X				

<u>તીટકત</u>	ધા	<u>ધાડધાડ</u>	<u>દીડદીડ</u>	
2				
<u>નાડનાડ</u>	<u>તીટતીટ</u>	<u>કતીટધા</u>	<u>તીટકત</u>	
0				
<u>કતીટધા</u>	<u>તીટકત</u>	<u>કતીટધા</u>	<u>તીટકત</u>	ધા
3				X

(4) ત્રિપદ્લી : જે “ગત”માં ગ્રષ ભાગ હોય અને ગ્રષ લયમાં વાગતી હોય એટલે કે તીગુન, ચૌગુન, છગુનમાં વાગતી રચનાને ત્રિપદ્લી કહેવામાં આવે છે, જેમાં ગ્રષ લય હોવી જરૂરી છે.

તાલ-ત્રિતાલ ત્રિપદ્લી :

ઉદાહરણ :

<u>કીતધે</u>	<u>તેટકત</u>	<u>ગદીગન</u>	<u>ધાત્રકધે</u>	
X				
<u>તેટેકતા</u>	<u>ગદીગન</u>	<u>ધાતીડ</u>	<u>ધાકત</u>	
2				
<u>ઘેટેટકતાગ</u>	<u>દીગનધાત્રક</u>	<u>ઘેટેકતાગ</u>	<u>દીગનધાડતી</u>	
0				
<u>ધાકતધે</u>	<u>તેટકતાગદીગન</u>	<u>ધાત્રકધેટેકતા</u>	<u>ગદીગનધાતી</u>	ધા
3				X

(5) ચૌપદ્લી : જે “ગત”માં ચાર ભાગ હોય તેવી રચનાને ચૌપદ્લીગત કહેવાય છે.

તાલ-ત્રિતાલમાં ચૌપદ્લી :

ઉદાહરણ :

<u>તીડ</u>	<u>ટક</u>	<u>ડતા</u>	<u>ગડ</u>	
X				
<u>દીગ</u>	<u>ડન</u>	<u>ધાડ</u>	<u>તીટ</u>	
2				
<u>કતા</u>	<u>ગદી</u>	<u>ગન</u>	<u>ધાડ</u>	
0				
<u>તીટકતા</u>	<u>ગદીગન</u>	<u>ધાડડ</u>	<u>તીટકતાગદીન</u>	ધા
3				X

(6) મુખડા : ઠેકો શરૂ કર્યા બાદ ઠેકાનાં મૂળભોલ છોડી અને અન્ય બોલ વગાડી સમ બતાવવામાં આવે તેને ‘મુખુ’ કહેવામાં આવે છે.

ઉદાહરણ : મુખુ-ત્રિતાલ :

ધા	ધી	ધી	ધા	
X				
ધા	ધી	ધી	ધા	
2				
ધા	તી	તી	તા	
0				
<u>તાકેતીના</u>	<u>ક્રીટકતા-તીર</u>	<u>ક્રીટકતીરકીટ</u>	<u>તકતા-તીરકીટ</u>	ધા
3				X

(7) મોહરા : ઠેકો શરૂ કરતાં પહેલાં જ નાના પરંતુ ચોક્કસ બોલસમૂહ વગાડીને ‘સમ’ બતાવવામાં આવે તેને મોહરા કહેવાય છે.

15	16	ધા	ધી	ધી	ધા
<u>કડાન તીરકીટ</u>	<u>તકતાડ તીરકીટ</u>	X			
ધા	ધી	ધી	ધી	ધા	
2					
ધા	તી	તી	તા	તા	
0					
તા	ધી	ધી	ધા	ધા	
3					X

(8) લગ્ગી : દાદરા, કહેરવા જેવા તાલોમાં કાયદાની માફક વાગતી રચના કે જેનો પ્રસ્તાર કરવામાં આવતો નથી તેને લગ્ગી કહેવાશે. તેનો અધિક વિસ્તાર ના કરતા ઉલટપુલટ કરી વગાડવામાં આવે છે. લગ્ગી ઔગુન તથા અંગુનમાં વગાડવામાં આવે છે.

ઉદાહરણ કહેરવા તાલમાં લગ્ગી :

(1)	ધા	તી	ના	ડા	તા	ધી	ના	ડા
	X				0			
(2)	ધી	ડ	તા	તા	કી	ડ	ધા	તા
	X				0			

(9) નૌહકા : કોઈ પણ તિહાઈ અથવા રચનાને ગ્રાં વખત વગાડીને અંતિમ “ધા” સમ ઉપર આવે અને તેમાં 9 “ધા” આવે તેને “નૌહકા” કહેવાય છે. અહીં નૌહકા તિહાઈ રજૂ કરેલ છે.

તાલ-ત્રિતાલમાં નૌહકા તિહાઈ :

ઉદાહરણ :

<u>ગાદીગન</u>	<u>ધાડગાદી</u>	<u>ગનધાડ</u>	<u>ગાદીગન</u>	
X				
<u>ધાડડડ</u>	<u>ડડડડ</u>	<u>ગાદીગન</u>	<u>ધાડગાદી</u>	
2				
<u>ગનધાડ</u>	<u>ગાદીગન</u>	<u>ધાડડડ</u>	<u>ડડડડ</u>	
0				
<u>ગાદીગન</u>	<u>ધાડગાદી</u>	<u>ગનધાડ</u>	<u>ગાદીગન</u>	
3				
				ધા
				X

સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

- (1) ચકધાર કેટલા પ્રકારની હોય છે ?
- (2) નૌહકાની વ્યાખ્યા ઉદાહરણ સહિત જણાવો.
- (3) કહેરવા તાલમાં બે લગ્ની લિપિબદ્ધ કરો.
- (4) પરનની વ્યાખ્યા આપી ઉદાહરણ સહિત જણાવો.

2. માંગ્યા પ્રમાણે લખો :

- (1) તાલ ત્રિતાલમાં એક દુપદ્ધી ગત બનાવો જેમાં બે પ્રકારની લયનો પ્રયોગ કરવામાં આવે છે.
- (2) તાલ ત્રિતાલમાં આપેલ પરનના જેવા બીજા બોલનો ઉપયોગ કરીને પરન બનાવો.
- (3) તાલ ત્રિતાલમાં એક સાઢી ચકધાર બનાવો.
- (4) તાલ ત્રિતાલમાં બે માગાના બે મુખડા બનાવો.
- (5) તાલ દાદરામાં બે અલગ અલગ લગ્ની લખો.
- (6) તાલ કહરવામાં બે અલગ અલગ લગ્ની લખો.
- (7) તાલ ત્રિતાલમાં એક નૌહકા ઉદાહરણમાં આપેલ બોલમાં અલગ બોલનો ઉપયોગ કરી બનાવો.



પ્રસ્તાવના

ઉત્તર હિન્દુસ્તાની સંગીતમાં ગાયન, વાદન અને કથક નૃત્યમાં ખાસ કરીને તબલા વાધનો ઉપયોગ થાય છે. શાસ્ત્રીય સંગીતમાં જ્યાલ ગાયન, હુમરી, ટપ્પા, તરાના ત્રિવટ, ચતરંગ, દાદરા વગેરે ગાયન શૈલીઓમાં તબલા વાધનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત તબલાનું એકલ વાદન પણ કરવામાં આવે છે.

એક સારા તબલાવાદક બનવા માટે ગાયનની વિવિધ શૈલીઓની જાણકારી હોવી આવશ્યક છે. માટે આ એકમમાં જ્યાલ, ધ્રુપદ, ધમાર, હુમરી જેવી ગાયનશૈલીઓની વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે. આ શૈલીઓથી માહિતગાર બની તેની સાથે કેવી રીતે તબલાસંગત કરી શકાય ? તે આ એકમનો હેતુ છે.

(1) જ્યાલ : જ્યાલ એ ફારસી ભાષાનો શબ્દ છે, જેનો અર્થ થાય છે ‘કલ્પના.’ કલ્પનાશક્તિને આધારે જે ગીતની રચના કરવામાં આવે, તેને ‘જ્યાલ’ કહે છે. બીજુ વ્યાખ્યા આ રીતે પણ આપી શકાય કે ‘ગીતનો એવો પ્રકાર કે જેમાં રાગના નિયમોનું પાલન કરીને આલાપ, તાન, બોલતાન અને તાલથી સજીવીને ગાયક પોતાની ભાવનાઓની અભિવ્યક્તિ કરે, તો તેને ‘જ્યાલ’ કહે છે.

જ્યાલનો આવિજ્ઞાર 15માં સૈકામાં જૈનપુરના સુલ્તાન હુસૈન શર્કીએ કર્યો એવું માનવામાં આવે છે. એ સમયે ધ્રુપદ-ધમાર ગાયકીનું વધારે પ્રાધાન્ય હતું. ધ્રુપદ ગાયન કરતાં જ્યાલ ગાયન હલકી કોટિનું મનાતું હતું, પરંતુ, 18માં સૈકામાં મુગલ બાદશાહ મુહમ્મદશાહ રંગીલેના રાજગાયકો સદારંગ અને અદારંગ જ્યાલ ગાયનને વધારે પ્રચારમાં લાવ્યા. તેમણે હજારો જ્યાલોની રચના કરી અને પોતાના શિષ્યોને શિખવાડીને તેનો પ્રચાર-પ્રસાર કર્યો. સદારંગ-અદારંગ પણી મનરંગ, હરરંગ, દિલરંગ અને કુવરશ્યામ વગેરેએ જ્યાલોની રચના કરી તેના પ્રચાર-પ્રસારનું કામ આગળ વધાર્યું.

જ્યાલ ગાયન એવી શૈલી છે જેમાં ગાયક ગીતને વિભિન્ન આલાપ, તાન, ઝટકા, મૂર્કા, મીંડ, અલંકારો વગેરેથી સજીવીને એક નવું ચઢિયાતું મનોહર રૂપ પ્રદાન કરે છે. જ્યાલમાં સ્વરોની સ્થિરતા અને ચપળતા બંને ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. કેટલાક સંગીતજ્ઞો જ્યાલમાં ગમકનો પ્રયોગ પણ કરે છે. જ્યાલમાં સ્વર ચમત્કૃતિ અને સ્વર સૌંદર્ય પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. જ્યાલમાં શુંગારરસ વિશેષ જોવા મળે છે.

જ્યાલના બે પ્રકાર છે : (I) બડાઝ્યાલ (II) છોટાઝ્યાલ.

(I) બડાઝ્યાલ : વિલંબિત લયમાં ગવાતા જ્યાલને ‘બડાઝ્યાલ’ કહે છે. આ ગાયન સાથે વાદ તરીકે તબલાનો પ્રયોગ થાય છે. બડા ઝ્યાલ એ વિલંબિત એકતાલ, વિલંબિત તિલવાડા, વિલંબિત ઝૂમરા, વિલંબિત ત્રિતાલ, વિલંબિત આડા ચૌતાલ વગેરે તાલોમાં ગવાતા આવે છે. બડાઝ્યાલમાં શબ્દો ખૂબ ઓછા હોય છે. જ્યાલના બે વિભાગ હોય છે : (1) સ્થાયી અને (2) અંતરા. કેટલાક સંગીતજ્ઞો બડાઝ્યાલ પૂર્વે વિસ્તારમાં આલાપ કરે છે. ત્યારબાદ બડાઝ્યાલની સ્થાયી અંતરા ગાયા પણી તેમાં આલાપ, બોલ આલાપ, તાન, બોલતાન લેવામાં આવે છે.

(II) છોટાઝ્યાલ : મધ્યલય અને કુતલયમાં ગવાતા જ્યાલને ‘છોટાઝ્યાલ’ કહે છે. છોટાઝ્યાલ ગીતની રચના બડાઝ્યાલની જેમ જ સંક્ષિપ્ત હોય છે. તેમાં પણ સ્થાયી અને અંતરા એમ બે વિભાગ હોય છે. આ ગીતોમાં શુંગાર અને કરુણરસ વિશેષ જોવા મળે છે. છોટાઝ્યાલની પ્રકૃતિ મહદૂઅંશે ચપળ હોય છે. છોટાઝ્યાલ એ ત્રિતાલ, એકતાલ, ઝપતાલ, ઝૂપક, આડાચૌતાલ વગેરે તાલોમાં ગવાતા આવે છે. છોટાઝ્યાલમાં પણ બડાઝ્યાલની જેમ આલાપ, બોલ-આલાપ, સરગમ, કણ, મીંડ, ઝડકા, મૂર્કા, બરાબરની તાન, અલંકારીક તાનો, બોલતાનો વગેરે લેવામાં આવે છે.

(2) ધ્રુપદ : ધ્રુપદ એ ઉત્તર હિન્દુસ્તાની સંગીતનો એક પ્રાચીન ગીતપ્રકાર છે. ધ્રુપદનો આવિજ્ઞાર ક્યારે અને કોણે કર્યો એ નિશ્ચિત કહી શકતું નથી. આ વિશે વિદ્વાનોમાં ઘણા મત-મતાંતર છે. અવિકાંશ વિદ્વાનોનું માનવું છે કે પંદરમી શતાબ્દીમાં જવાલિયરના રાજી માનસિંહ તોમરે આની રચના કરી. પરંતુ ઘણા વિદ્વાનો એમ માને છે કે ધ્રુપદ ગાયન પંદરમી શતાબ્દી પહેલાં પ્રચલિત હતું. આ બધા મતમતાંતરોનો વિચાર કરીને એવું કહી શકાય કે ધ્રુપદ ગાયનનો આવિજ્ઞાર પંદરમી શતાબ્દીની આગળ-પાછળ થયો હોવો જોઈએ.

પ્રાચીનકાળમાં આપણા ઋષિમુનિઓ સંસ્કૃતના શલોકો ગાઈને ભગવાનની આરાધના કરતા હતા. ધીમે ધીમે આમાં પરિવર્તન આવતા ધ્રુપદ શૈલીનો જન્મ થયો હોય એવું માની શકાય, કેમ કે ધ્રુપદમાં પણ ઈશ્વરભક્તિ સુતુિ, પરમાત્માની લીલાઓ અને મહાયોદ્ધાઓના પરાક્રમોનું વર્ણન હોય છે. અકબર બાદશાહના સમયમાં જેટલા ઉચ્ચ કોટિના ગાયક હતા તે બધા ધ્રુપદ ગાયક હતા. આ ગાયકોમાં સ્વામી હરિદાસ, તાનસેન, બૈજુ બાવરા, ચિંતામણિ મિશ્ર, નાયક ગોપાલ વગેરે પ્રસિદ્ધ હતા. તેમણે રચેલ અનેક ધ્રુપદ આજે પણ સાંભળવા મળે છે. વર્તમાન સમયમાં ડાંગર બંધુઓ, બહેરામ ખાં, ગુરેચા બંધુઓ વગેરે વિશેષ છે.

વર્તમાન સમયમાં ધ્રુપદ એક ગંભીર અને વીરરસપ્રધાન જોરદાર ગાયન માનવામાં આવે છે. ધ્રુપદના ગીતો મુખ્યત્વે હિન્દી, ઉર્દૂ અને પ્રજ ભાષામાં સાંભળવા મળે છે. આ એક મર્દની અવાજનું ગાયન છે. આમાં વીર, શૂંગાર અને શાંતરસ મુખ્ય છે. ધ્રુપદના ચાર ભાગ જોવા મળે છે. (1) સ્થાયી (2) અંતરા (3) સંચારી (4) આભોગ. ધ્રુપદ અવિકાર ચૌતાલ, સુલતાલ, ઝંખા, તીવ્રા, બ્રહ્મતાલ, રુક્રતાલ વગેરે તાલોમાં ગાવામાં આવે છે. ધ્રુપદગાયન સાથે પખાવજ જેવા ગંભીર વાદની સંગતિ કરવામાં આવે છે.

ધ્રુપદમાં સર્વપ્રથમ નોમૂઠોમૂના આલાપ કરવામાં આવે છે. આલાપના ચાર અંગ હોય છે. આલાપ ત્રીજા અંગમાં લયબદ્ધ થાય ત્યારે તેની ગતિ વધતી જાય છે. આ જ સ્થાનથી તેમાં ગમકોનો પ્રયોગ શરૂ થાય છે. ધ્રુપદમાં ખટક અથવા સપાટ તાનોનો પ્રયોગ થતો નથી. આલાપ પછી ધ્રુપદના ચારેય ભાગ ગાવામાં આવે છે. ધ્રુપદમાં લયકારીનું વિશેષ મહત્વ છે. પ્રાચીનકાળમાં ધ્રુપદની ચાર વાણીઓ (શૈલીઓ) હતી : (1) ગોબરહાર વાણી (શુદ્ધ વાણી) (2) ખંડહાર વાણી (3) ડાંગર વાણી (4) નૌહાર વાણી.

છેલ્લા દોઢસો વર્ષથી ધ્રુપદ ગાયનનો પ્રચાર ઓછો થઈ ગયો છે. આ ગાયન વર્તમાન સમયમાં વૈષ્ણવોની “હવેલી સંગીત” પરંપરામાં જળવાયેલું જોવા મળે છે.

(3) ધમાર : ધમારને ‘હોરી’ કે ‘હોલી’ ગીત પણ કહેવામાં આવે છે. એટલે કે જ્યારે ‘હોરી’ નામના ગીતને ધમાર તાલમાં ગાવામાં આવે, ત્યારે તેને ‘ધમાર’ કહેવામાં આવે છે. ધમારગાયનમાં મોટે ભાગે ફાગણ માસમાં ગવાતી પ્રજની હોળીનું વર્ણન હોય છે તેમ જ કેસૂડા, ગુલાબના રંગો અને પિચકારી દ્વારા હોળી રમતાં ફૂલા, રાધા અને ગોપીઓનું વર્ણન હોય છે.

ધમારગાયનની શરૂઆતમાં ધ્રુપદની જેમ જ નોમૂઠોમૂના આલાપ કરી ગીત શરૂ કરવામાં આવે છે. ત્યારબાદ તેમાં હુગુન, તિગુન, ચૌગુન, ગમક વગેરેનો પ્રયોગ કરવામાં આવે છે. ધ્રુપદની જેમ જ આ ગીતપ્રકાર ગંભીર અને જોરદાર છે. હાલમાં આ ગીતપ્રકાર ‘હવેલીસંગીત’ તરીકે ઓળખાય છે અને તે વૈષ્ણવોના મંદિરોમાં ગવાય છે. આ ગાયન સાથે વાદ સંગીતમાં મૂંદુંગ અથવા પખાવજનો ઉપયોગ થાય છે. અકબર બાદશાહના સમયમાં ધમારગાયનના ઉચ્ચ કોટિના ગાયકોમાં સ્વામી હરિદાસ, તાનસેન, બૈજુ બાવરા, ચિંતામણિ મિશ્ર વગેરે પ્રસિદ્ધ હતા.

(4) હુમરી : હુમરી ગાયનના આવિજ્ઞારના વિષયમાં કશું સ્પષ્ટ કહી શકતું નથી. કેટલાક વિદ્વાનોનું એવું કહેવું છે કે આનો આવિજ્ઞાર લખનઉમાં થયો અને તેનો આવિજ્ઞાર ગુલામનભીએ કર્યો હતો, પરંતુ પ્રાચ્ય લિખિત દસ્તાવેજો પ્રમાણે હુમરીનો ઉદ્ભબ 16મી અથવા 17મી સદીની આસપાસમાં થયો હોવાનું માનવામાં આવે છે. હુમરીનો સંબંધ પ્રાચીન ગીતપ્રકાર ‘ચર્ચરી પ્રબંધ’ અથવા ‘હલ્લીસક ગીતિ’ સાથે છે તેવું પણ માનવામાં આવે છે. તો કેટલાકના મતે હુમરીનો ઉદ્ભબ ઉત્તર ભારતીય લોકગીતો ખાસ કરીને ગંગા-જમુના નદીઓની વચ્ચેના પ્રદેશોના લોકગીતોમાંથી થયો હોવાનું જણાય છે.

“હુમરી” હિન્દી ભાષાના શબ્દ ‘હુમક’ પરથી ઉત્તરી આવ્યો છે, જેનો અર્થ થાય છે ‘આકર્ષક લયકતી ચાલ.’ આમ, તેનો સાહિત્યિક અર્થ જોઈએ તો આકર્ષક, કામુક, સુમધુર, તાલબદ્ર સંગીતની ચાલ કહી શકાય. લખનાઉના અંતિમ નવાબ વાજિદ અલી શાહે સો વર્ષ પહેલાં હુમરીને પ્રોત્સાહન આપી તેને વિશેષ લોકપ્રિય બનાવી હતી. તેઓ સ્વયં હુમરીના ગાયક હતા અને ‘અખ્તરમિયાં’ના ઉપનામથી અનેક હુમરીઓની રચના કરી હતી.

હુમરી એ ગીતનો એવો પ્રકાર છે કે જેમાં રાગની શુદ્ધતાની તુલનાએ ભાવ અને સૌંદર્યને વધારે મહત્વ આપવામાં આવે છે. તેની પ્રકૃતિ ચપળ અને દુત હોય છે. હુમરી ગાયનના પણ બે વિભાગ હોય છે : (1) સ્થાયી (2) અંતરા. ક્ષુદ્ર પ્રકૃતિના રાગો જેવા કે-કાફી, ખમાજ, તિલક કામોદ, તિલંગ, ઝિઝોટી, બરવા, માંડ, ભૈરવી વગેરેમાં ગાવામાં આવે છે. હુમરીમાં શુંગાર રસની પ્રધાનતા જેવા મળે છે. હુમરીમાં મુખ્યત્વે રાધા-કિષ્ણની મેમલીલાઓનું વર્ણન, પ્રિય-પ્રિયતમાનું વિરહ વર્ણન અથવા નખશિખ વર્ણનો જેવા મળે છે. હુમરી ગાયન મુખ્યત્વેની હિન્દીની ઉપભાષાઓ-પ્રાદેશિક ભાષાઓ જેવી કે અવધી, ભોજપુરી, મિર્જાપુરી, વગેરેમાં જેવા મળે છે.

હુમરી ગાયનમાં લખનાઉ, બનારસ અને પંજાબ — આ ત્રાણેય પ્રદેશો પોતાની અલગ-અલગ વિશિષ્ટતાઓ ધરાવે છે તેથી જ હુમરીના ત્રણ પ્રકાર પડે છે : (1) બનારસી (2) લખનવી (3) પંજાબી. બનારસ અંગની હુમરીમાં શબ્દોની બઢત ધીરે ધીરે લોચદાર સ્વરસમૂહો દ્વારા થાય છે. બનારસની હુમરીમાં વિયોગ વથાની પરાકાણ જેવા મળે છે. લખનવી હુમરીમાં કામુકતા અને રૂમાનિયતને અટપટી રીતે મૂદુતાપૂર્વક અંગોના હાવભાવને સ્પષ્ટ કરે છે. જ્યારે પંજાબ અંગની હુમરીઓમાં કોમળ-તીવ્ર બધા મળીને બારેય સ્વરોની નાની-નાની પેચદાર તાનો અને મુર્કિઓનો વધુ પ્રયોગ કરવામાં આવે છે.

વર્તમાન સમયમાં હુમરી ગાયન વધારે પ્રચારમાં જેવા મળે છે. પ્રસિદ્ધ હુમરી ગાયકોમાં બેગમ અખ્તર, રસુલનભાઈ, સિદ્ધેશ્વરી દેવી, શોભા ગુર્દુ, ગિરીજા દેવી, બડી મોતિબાઈ, મહાદેવ મિશ્રા, પં. છન્નુલાલ મિશ્ર વગેરે વિશેષ છે.

આ ગાયકીમાં દાદરા, કહેરવા, ધુમાળી, દીપચંદી, જત અધ્યા જેવા તાલોનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. તેમ જ ગાયનમાં સ્થાયી પછી અંતરામાં જતી વખતે લયને વધારી તેમાં લગ્નીનો ઉપયોગ કરી બઢત કરવામાં આવે છે. અહીં તબલાવાદક લગ્નીનો ઉપયોગ કરી ગાયનની શોભા વધારે છે.

સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

- (1) જ્યાલ ગાયનનો આવિષ્કાર કોણે કર્યો ?
- (2) જ્યાલની વ્યાખ્યા જણાવો.
- (3) ધ્રુપદ ગાયન સાથે તાલવાદ તરીકે કોણી સંગત કરવામાં આવે છે ?
- (4) ધમાર તાલનો ઉપયોગ કર્ય ગાયકીમાં થાય છે ?
- (5) હુમરી સાથે વગાડવામાં આવતા કોઈ પણ ત્રણ તાલની જાણકારી આપો.

2. ખાલી જગ્યા પૂરો :

- (1) જ્યાલ ગાયનને પ્રચારમાં અને રાજગાયકો લાવ્યા.
- (2) જ્યાલના પ્રકાર છે.
- (3) ધ્રુપદ ગાયન સાથે બાજનો તાલ વગાડવામાં આવે છે.
- (4) ધમાર ગાયનમાં મુખ્યત્વેનું વર્ણન હોય છે.



પ્રસ્તાવના

આ એકમ તબલાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વાનું છે. આ એકમમાં તબલાના વર્ણ કેટલા અને દરેક વર્ણ ને કેવી રીતે તબલા પર વગાડવામાં આવે છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે, જે ખૂબ જરૂરી છે. બોલ એના નિશ્ચિત સ્થાન પર વગાડવામાં આવે તો જ તબલા પર અવાજ સ્પષ્ટ સાંભળવામાં આવે છે, જેની માહિતી આ એકમ દ્વારા વિદ્યાર્થીઓને પ્રાપ્ત થશે.

તબલાના દસ વર્ણની વિસ્તૃત જાણકારી

તબલાના દસ વર્ણ :

તબલાના વિદ્યાર્થીઓને તબલા શીખતાં પહેલાં તબલાના વર્ણો એટલે કે તબલાના મૂળાક્ષરોની જાણકારી હોવી અત્યંત જરૂરી છે. જેવી રીતે આપણે કોઈ ભાષા શીખીએ તો બ્યાકરણની જરૂરિયાત હોય છે તેવી જ રીતે વર્ણની જાણકારી હોવી જરૂરી છે.

તબલા પર વગાડવામાં આવતા વર્ણો :

- | | |
|------------------|-----------------|
| (1) તા અથવા ના | (2) તિ અથવા તિં |
| (3) દિં અથવા થૂં | (4) તે અથવા તિં |
| (5) તૂ | (6) તે અથવા ટે |

બાંધા પર વગાડવામાં આવતા વર્ણો :

- | | |
|----------------|------------------|
| (7) ધે અથવા ગે | (8) ક, કો કે, કટ |
|----------------|------------------|

બંને હાથથી વગાડવામાં આવતા વર્ણો :

- | | |
|--------|----------|
| (9) ધા | (10) ધિં |
|--------|----------|


તબલાના અક્ષરોને વગાડવાની રીત :

તબલામાં બાંધા અને દાંયા બંને મળીને 24 અક્ષરો વગાડી શકાય છે, જેમાં 20 અક્ષર દાંયા (તબલા) પર અને 4 અક્ષર બાંધા (ડુંગા) પર વગાડી શકાય છે.

- (1) દાંયા (તબલા)ના શર્દુ : ત, થ, દ, ન, ટ, ઢ, ન, ત્ર, ર, લ
- (2) બાંધા (ડુંગા)ના શર્દુ : ક, ગ, ધ, ધ

જ્યારે ઉપર્યુક્ત શર્દોમાં માત્રાઓ લગાવવાથી એનું સ્વરૂપ બદલાઈ જાય છે. જેમ કે - રિ, દિ, ધુ, તિ, તૂ, ના, ટે હવે ઉપર્યુક્ત શર્દોને તબલા પર વગાડવાની પદ્ધતિ જાણીએ.



(1) બાંધા (ડુંગા) પર વગાડતા બોલ :



કે/કે/કિ :


ડુંગા પર ડાબા હાથની બધી આંગળીઓથી સ્થાઠી પર હાથ મૂકી વગાડવાથી “ક” તથા હાથને ગોળાકાર કરી સ્થાઠીથી ઉપર હાથથી વગાડવાથી “કે/કિ” શર્દનો અવાજ નીકળશે.

(2) ધ/ધિ/ગો/ળી :



આ બધા બોલ બાંધા પર ગોળાકાર હાથ મૂકીને સ્યાહીની ઉપરના ભાગ પર આધાતથી બધાં જ બોલ નો અવાજ નીકળશે.


(1) દાંયા (તબલા) પર વગાડતા બોલ :



ત, તા, ન, ના, ડા :


આ બધાં જ બોલ તબલા પર જમણા હાથની પહેલી આંગળીથી ચીંટી પર વગાડવાથી બધાં જ બોલનો અવાજ નીકળશે.

(2) તી/તૂ :




આ બોલ તબલા પર જમણા હાથની પહેલી આંગળીની સ્યાહી પરના કિનારી પર વગાડવાથી તી/તૂ શબ્દનો અવાજ નીકળશે.

(3) તિ/તે :




આ બોલ તબલા પર જમણા હાથની બીજી આંગળીથી સ્યાહીની વચમાં વગાડવાથી “તિ/તે” શબ્દનો અવાજ નીકળશે.

(4) ટ (તિરટ) ત/ર :




આ બોલ તબલા પર જમણા હાથની પહેલી આંગળીથી સ્યાહીની પર વગાડવાથી (તિરટ)/ત/ર આ શબ્દનો અવાજ નીકળશે.

(5) ટ (તિરકીટ) :




આ બોલ તબલા પર જમણા હાથની ત્રીજી આંગળીથી સ્યાહી પર વગાડવાથી “ટ” શબ્દ જે ‘તિરકીટ’માં આવે છે તેનો અવાજ નીકળશે.

(6) કતુ/ત, તતુ :




આ બોલ તબલા પર જમણા હાથની બીજી અને ત્રીજી આંગળી એક સાથે તબલાની સ્યાહી પર વગાડવાથી કતુ, તતુનો અવાજ નીકળશે.

(7) તકુ :




તબલા પર જમણા હાથની ચારે આંગળીઓ ભેગી કરી સ્યાહી પર વગાડવાથી તકુનો અવાજ નીકળશે.

(8) દિ :




આ બોલ તબલા પર જમણા હાથનો પૂરો પંજો સ્યાહી પર વગાડવાથી “દિ” શબ્દનો અવાજ નીકળશે.

(9) દ, ન :




આ બોલને તબલા પર જમણા હાથની ત્રીજ આંગળીથી સ્યાહી પર વગાડવામાં આવે છે. જે “ગીડુનગ”, “વિન્દુંચિના” આ પ્રકારના બોલોમાં ત્રીજ આંગળીનો ઉપયોગ કરવામાં આવે છે.

(10) ત્ર :



આ બોલ તબલા પર જમણા હાથની પદેલી બે આંગળીથી સ્યાહી પર વગાડવાથી “ત્ર”નો અવાજ નીકળી શકે છે.

(11) ડાન્/રાન્ :





આ બોલ તબલા પર જમણા હાથની આંગળીથી તબલાની સ્યાહી પર “ગીડાન” અથવા “ગીતરાન” જેવા બોલ વગાડતી વખતે ડાન/રાન શબ્દનો અવાજ નીકળી શકશે.

બંને હાથથી વગાડવામાં આવતા બોલ



દાંયા તથા બાંયાના સંયુક્ત વર્ણ :

(1) “ધા” :





શર્દ બંને હાથને તબલા અને બાંયા પર મૂકીને તબલા પર પહેલી આંગળીથી ચાંટી પર અને ડગા પર હાથને ગોળાકાર રાખીને બંને હાથથી એક સાથે વગાડવાથી “ધા” શર્દનો નીકળશે.

(2) ધિં :



બંને હાથને પહેલાંની જેમ તબલા પર મૂકીને તબલા પર સ્થાઠી અને ચાંટી વચ્ચે પહેલી આંગળીથી અને ડગા પર પૂરા પંજાની બે આંગળીથી એકસાથે વગાડવાથી “ધિં” શર્દનો અવાજ નીકળશે.

(3) ધિ/ધેત્રુ :



આ બોલ જમણા હાથથી તબલા પર બીજી અને ત્રીજી આંગળી સ્થાઠી પર અને બાંયા પર બીજી અને ત્રીજી આંગળીથી બંને હાથે એકસાથે વગાડવાથી ધિ/ધેત્રુ શર્દનો અવાજ નીકળશે.

સ્વાધ્યાય

1. સાચા જવાબ સામે ન ટીક કરો :

(1) તબલાના મૂળ વર્ણ કેટલા છે ?

(A) 10

(B) 24

(C) 28

(D) 15

- (2) જમણા હાથથી તબલા પર કેટલા વર્ષ વગાડી શકાય છે ?
 (A) 4 (B) 6 (C) 8 (D) 10
- (3) ડાબા હાથથી બાંધા પર કેટલા વર્ષ વગાડી શકાય છે ?
 (A) 2 (B) 4 (C) 5 (D) 8
- (4) બંને હાથથી કેટલા વર્ષ વગાડી શકાય છે ?
 (A) 1 (B) 2 (C) 3 (D) 5
- (5) જમણા અને ડાબા હાથથી એટલે કે દાંધા અને બાંધા પર ભેગા મળીને કેટલા બોલ વગાડી શકાય છે ?
 (A) 14 (B) 24 (C) 34 (D) 25

2. સાચા જવાબ સામે ✓ ટીક કરો :

- (1) “તા” શબ્દ તબલા પર કઈ આંગળીથી વગાડવામાં આવે છે ?
 (A) મધ્યમા (B) તર્જની (C) અનામિકા (D) કનિષ્ઠકા
- (2) “તું” શબ્દ તબલા પર કઈ જગ્યા પર વગાડવામાં આવે છે ?
 (A) ચાંટી (B) સ્વાહી (C) મૈદાન (D) ગજરો
- (3) બંને હાથથી કયો શબ્દ (બોલ) વગાડવામાં આવે છે ?
 (A) ના (B) ધા (C) ઇ (D) તું

3. તબલાનું ચિત્ર દોરી તબલાનાં અંગોનું વર્ણન કરો :

નોંધ : હાથની પહેલી આંગળીને તર્જની, બીજી આંગળીને મધ્યમાં, ત્રીજી આંગળીને અનામિકા, ચોથી આંગળીને “કનિષ્ઠકા” તથા અંગૂઠાને અંગુષ્ઠ કહેવામાં આવે છે. પરંતુ અહીં વિદ્યાર્થીઓને સુવિધા માટે આંગળીના નંબર આપવામાં આવ્યા છે.



પ્રસ્તાવના

સંગીત એક એવો વિષય છે જેમાં સૈદ્ધાંતિક અને કિયાત્મક બંને પાસાની જરૂરિયાત સમાયેલી છે, જેમાં વાંચન પણ ખૂબ જરૂરી છે. આ એકમાંથી વિદ્યાર્થીઓને જુદા જુદા વિષયો દ્વારા સંગીતની સમજ આપવામાં આવી છે. જેમાં સંગીતમાં ગાયન-વાદન અને નૃત્યમાં સંગીતમાં સાથ સંગતની ખૂબ જ જરૂરિયાત હોય છે. સંગત સારી રીતે આવડે તો જ સંગીતના કાર્યક્રમોમાં શ્રોતાઓને આનંદ પ્રાપ્ત થાય. તો સંગીતના વિવિધ પાસાઓની સમજ અને સંગતનું મહત્વ આ એકમથી જાણી શકાશે. તેમજ એકલ તબલાવાદનમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, રજૂઆત કરતી વખતે કમબદ્ધ રીતે પેશકાર, કાયદા, પલટા, રેલા, મુખડા, ટુકડા, પરન વગેરે ક્યારે વગાડવું જેથી એકલવાદન થી પણ શ્રોતાઓને આનંદ મળે અને કલાકારની ઓળખ બને તે વિશેની વિસ્તૃત જાણકારી આ એકમ દ્વારા પ્રાપ્ત થશે. સાથે તાલને સાથેનો સંબંધ છે તો જાણવા માટે જેમ પદમાં વિવિધ પ્રકારના છંદનો ઉપયોગ થાય છે તે રીતે તાલની ભાષામાં તથા તેના ઉદ્ભબવસ્થાનમાં ક્યો છંદ સમાયેલ છે તેની પણ જાણકારી તેમજ કેટલા પ્રકારના છંદ હોય છે જેની વિસ્તૃત જાણકારી આ એકમ દ્વારા પ્રાપ્ત થશે.

(1) સંગીતમાં સાથ-સંગતનું મહત્વ :

આ વિષયમાં “ગાયન, વાદન, નૃત્ય” સાથે સાથ-સંગતનું શું મહત્વ છે અને તબલાવાદકની ભૂમિકાઓ શું છે તે દર્શાવ્યું છે.

(2) સ્વતંત્ર તબલા વાદનની રીત :

આ વિષયમાં સ્વતંત્ર તબલાવાદન અલગ-અલગ ધરાનામાં કઈ રીતે કરવું તથા કરવામાં આવે છે તેની માહિતી આપવામાં આવી છે.

(3) છંદ અને તાલ :

આ વિષયમાં છંદ અને તાલની વ્યાખ્યા તથા છંદનો તાલમાં શું ઉપયોગ છે તથા તબલાવાદનમાં છંદશાસ્ત્રનો કેટલો ઉપયોગ થઈ શકે તેની નોંધ લખવામાં આવી છે.

(1) સંગીતમાં સાથ-સંગતનું મહત્વ : તબલાવાદકની મુખ્યત્વે બે ભૂમિકા હોય છે : (1) સંગત કરવી (2) સ્વતંત્ર તબલાવાદન કરવું.

સંગત કરવા માટે તબલાવાદકે ત્રણ શૈલી જોડે મુખ્યત્વે સંગત કરવાની રહે છે : (1) ગાયન (2) વાદન (તંતુવાદ, ઘનવાદ તથા સુશિરવાદ સાથે) (3) નૃત્ય સાથે જે તબલા અથવા પખાવજ વગેરે દ્વારા કરવામાં આવે છે.

સોલો એટલે કે સ્વતંત્ર તબલાવાદન માટે-હારમોનિયમ વાદક, સારંગી કે વાયોલિનની સંગત ઉપયોગી થાય છે. એ પણ સાથ-સંગાથ જ કહેવાશે.

એટલે કે સંગત બે પ્રકારની થાય છે : (1) સ્વરની સંગત (2) તાલ-લયની સંગત.

સંગીતમાં સાથ-સંગતનું ખૂબ જ મહત્વ છે. સાથ-સંગાથ વિનાનું સંગીત જરા પણ કર્ણપ્રિય તથા રુચિકર નથી લાગતું, કારણ કે સંગીતમાં સાથ-સંગાથ દ્વારા મુખ્ય બે ઉદેશ સિદ્ધ થાય છે. એક તો તેના દ્વારા લય તથા તાલની પ્રતિષ્ઠા થાય છે અને તેના દ્વારા રજૂ કરાતા સંગીતને નિયમબદ્ધ કરાય છે, જેનાથી તેની શુદ્ધતા પરખાઈ જાય છે. બીજો મુખ્ય ઉદેશ સંગીતને વધુ આનંદદાયક બનાવી શ્રોતાશાળા ને આનંદની અનુભૂતિ કરાવી શકાય છે.

ગાયકીમાં ઝ્યાલ સાથે વગાડાતા વિલંબિત લયના તાલોમાં પણ તેના નાના-નાના બોલોનો પ્રયોગ કરી ઝ્યાલ ગાયકીને રુચિકર બનાવી શકાય છે. આ ઉપરાંત છોટાઝ્યાલ તથા તરણાના જેવી રચનાઓ સાથે કુશળતાપૂર્વક સંગત કરી નાની ચીજો વગાડી વાતાવરણને હળવું બનાવી શકાય છે. બધું સાથ-સંગત દ્વારા જ શક્ય બને છે. તંતુ વાદ સાથે પણ વિલંબિત લય, મધ્યલય તથા “ઝાલા”ના પ્રયોગ વખતે દુતલયમાં કુશળતાપૂર્વક સાથ-સંગત કરવાથી સંગીત રુચિકર લાગે છે.

નૃત્ય સાથેની સંગત અભ્યાસ માગી લે છે, કારણ કે નૃત્યકારની રચના અને તેઓ દ્વારા રજૂ થતી રચના જુદી જુદી લયકારી તથા લયમાં હોય છે જેને અનુરૂપ સાથ-સંગત કરવી એ પણ કુશળતાનું કામ છે. સંગતકાર જો જાણકાર ના હોય તો સંગીત (નૃત્ય) નીરસ બની જશે. આથી સાથ-સંગતનું સ્થાન ભારતીય સંગીતમાં ખૂબ જ મહત્વનું બની રહે છે.

સ્વતંત્ર વાદનમાં પણ લહેરા સંગત લયબદ્ધ નહીં રહે તો તબલાવાદન શક્ય જ નહીં બને. આથી કુશળ સંગતકાર હોવો જરૂરી છે.

આખરે તો એક જ નિર્જર્બ નીકળે છે કે સાથ-સંગત વગરનું સંગીત નીરસ-અશાસ્ત્રીય લાગશે, કારણ કે સાથ-સંગત દ્વારા લય-તાલને નક્કી કરી તેને નિયમબદ્ધ બનાવી શકાય અને સંગીતને ગતિ આપવાનું કાર્ય થાય છે તથા મુખ્ય કલાકારનાં દોષો હોય અથવા તો સામાન્ય ભૂલને ધૂપાવી અને સાથ-સંગત કરવો એ પણ એક મહત્વનું પાસું છે.

(2) સ્વતંત્ર તબલાવાદન કરવાની રીત : જુદા જુદા ઘરાનામાં અલગ-અલગ રીતે સ્વતંત્ર તબલાવાદન થાય છે. પરંતુ તેનાં ક્રમની બાબતમાં લગભગ સામ્યતા જોવા મળે છે. બનારસ ઘરાનામાં તબલાવાદનની શરૂઆત “ઉઠાન” દ્વારા કરવામાં આવે છે. બાકી બીજા દરેક ઘરાનામાં “પેશકાર”થી વાદનની શરૂઆત થાય છે. ત્યારબાદ ચલનચારી, બાંટ, રેલા તથા દુતલયમાં ટુકડા, પરનો ચકધારો રજૂ થાય છે. આ વાદન શૈલી બનારસ ઘરાનાની શૈલી દર્શાવે છે. બાકી બીજા બધાં ઘરાનામાં પેશકાર બાદ, પેશકાર કાયદા, વિવિધ બોલોનાં કાયદા, વિવિધ લયનાં કાયદા રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ કોઈ “ચાલા” ઘણા ઘરાનામાં રજૂ કરવામાં આવે છે અને વાદનને “કહેરવા” તાલનો આનંદ આપવામાં આવે છે. “ચાલા” બાદમાં વિવિધ પ્રકારની ‘ગતો’નો પ્રયોગ કરવામાં આવે છે અને વાદનમાં વૈવિધ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ પ્રસ્તુતિ બાદ રેલા-જેમાં તીરકીટ અને ધીરધીરનાં પ્રયોગ દ્વારા તેયારી અને કલાકારે કરેલી મહેનતનો અનુભવ કરાવવામાં આવે છે.

(3) છંદ અને તાલ :

છંદ : નક્કી કરેલા અક્ષરો કે માત્રાઓ પ્રમાણે શબ્દોની કાવ્યરચના થાય છે તેને છંદ કહે છે.

તાલ : સંગીતમાં સમયને માપવાના સાધનને તાલ કહેવામાં આવે છે.

તાલનું મુખ્ય કામ સંગીતને નિયમબદ્ધ કરી સ્થિરતા પ્રદાન કરવાનું છે અને આ તાલને નિયમબદ્ધ કરવાનું કામ છંદનું છે.

છંદો બે પ્રકારનાં હોય છે : (1) અક્ષરમેળ છંદ (2) માત્રામેળ છંદ

અક્ષરમેળ છંદ : એટલે એવા છંદ કે જેની પ્રત્યેક પંક્તિનાં અક્ષરોની રચનાની સંખ્યા નક્કી કરેલી હોય છે. તેવા છંદને અક્ષરમેળ છંદ કહેવાય છે. લધુ-ગુરુ એ અક્ષરમેળ છંદનાં એકમો છે.

માત્રામેળ છંદ : માત્રામેળ છંદનો સંબંધ પંક્તિની રચનામાં અક્ષરો સાથે નથી હોતો, પરંતુ માત્રાની સંખ્યા સાથે હોય છે. અહીં લધુની 1 માત્રા તથા ગુરુની 2 માત્રા ગણવામાં આવે છે. તેનો સંબંધ તાલ સાથે હોય છે. તેમાં નિયત સંખ્યાની માત્રાસંખિનાં આવતનો હોય છે. આ માત્રાસંખિ 4 છે.

(1) ત્રિકલ (2) ચતુર્ભલ (3) પંચકલ (4) સપ્તકલ

(1) ત્રિકલ : ગ્રાણ માત્રાનાં સંખિસમૂહને ત્રિકલ કહે છે.

ઉદાહરણ : તાલ દાદરા ભર્ણોવા છંદ.

(2) ચતુર્ભલ : ચાર માત્રાનાં સંખિસમૂહને ચતુર્ભલ કહે છે.

ઉદાહરણ : કહેરવા-ત્રિતાલ-ધુમાળી રૂપધનાકશરી તથા તોટક છંદ.

(3) પંચકલ : પાંચ માત્રાનાં સંખિસમૂહને પંચકલ કહે છે.

ઉદાહરણ : જપતાલ-ભૂજંગપ્રમાત છંદ.

(4) સપ્તકલ : સાત માત્રાનાં સંવિસમૂહને સપ્તકલ કહે છે.

ઉદાહરણ : રૂપક, તેવરા, દીપચંદી ગીતાંગી છંદ (જૂલના છંદ)

સંગીત જગતમાં અક્ષરમેળ છંદો વધુ ઉપયોગી નથી પણ માત્રામેળ છંદ જ ઉપયોગી છે કારણ કે ગીત કે ગત એક જ તાલમાં રચાયેલા હોય છે અને તમે કુશળતાપૂર્વક કલાત્મક ફેરફાર કરી શકો છો અને તેનાં ઠેકામાં ફેરફાર કરી વૈવિધ્ય લાવી શકો છો. પ્રકારો પણ અનેક બનાવી શકાય છે. જ્યારે અક્ષરમેળ છંદમાં તે શક્ય નથી.

આમ, અનેક પ્રકારનાં છંદ સાહિત્યમાં ઉપલબ્ધ છે. પરંતુ કુશળ તબલાવાદક માત્રામેળ છંદનો અભ્યાસ કરી વાદનમાં વૈવિધ્ય લાવી શકે છે. પરંતુ તેના (છંદના) વાદનની પણ સીમા છે. ભડોવા છંદ, રૂપધનાકશરી છંદ, તોટક છંદ તથા ગીતાંગી છંદનો અભ્યાસ કરવામાં આવે તો અવશ્ય ફાયદો થાય.

સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના જવાબ આપો :

- (1) સંગતના કેટલા પ્રકાર છે ?
- (2) સાથ-સંગત માટે કયા વાધનો ઉપયોગ થાય છે ?
- (3) સ્વતંત્ર તબલાવાદનની રીત વર્ણવો.
- (4) છંદ અને તાલનું વર્ણન કરો.

2. સાચા જવાબ સામે ✓ ટીક કરો :

- (1) બડા ઘ્યાલ ગાયન કઈ લયમાં ગવાય છે ?

(A) મધ્યલય	(B) વિલંબિતલય	(C) દૂતલય	(D) આતિદૂતલય
------------	---------------	-----------	--------------
- (2) તંતુવાધમાં “જાલા” કઈ લયમાં વગાડવામાં આવે છે ?

(A) વિલંબિતલય	(B) આતિ વિલંબિતલય	(C) મધ્યલય	(D) દૂતલય
---------------	-------------------	------------	-----------
- (3) તબલાવાદન (એકલવાદન)ના અંતિમ ચરણમાં શું વગાડવામાં આવે છે ?

(A) પેશકાર	(B) કાયદા	(C) મુખડા	(D) ચકદાર
------------	-----------	-----------	-----------
- (4) સંગીતમાં કયા છંદનો ઉપયોગ થતો નથી ?

(A) રૂપધનાકશરી છંદ	(B) માત્રામેળ છંદ	(C) અક્ષરમેળ છંદ	(D) તોટક છંદ
--------------------	-------------------	------------------	--------------



પ્રસ્તાવના

તબલા એકલવાદન અને સાથ-સંગત માટે તેના બોલોની શુદ્ધતા ખૂબ આવશ્યક છે. તબલામાં નીકળતા બોલોને કેવી રીતે વગાડી શકાય ? જો આ માહિતી ના હોય તો સારા તબલાવાદક બની શકતું નથી. તબલા વાદનમાં બોલોની સ્પષ્ટ નિકાસવિધિ જરૂરી છે. માટે આ એકમમાં તબલાના વિવિધ બોલોની નિકાસવિધિની માહિતી આપવામાં આવી છે. જેનાથી તબલા વાદ પર તે બોલ સચોટ રીતે વગાડી શકાય.

(1) ગેગેનિટ : સૌપ્રથમ ડાબા હાથની મધ્યમા અને અનામિકા આંગળી વડે બાંધા પર પ્રહાર કરવાથી ‘ગે’ બોલ વાગશે. તે જ રીતે બીજી વાર ‘ગે’ બોલ વગાડીને જમણા હાથની મધ્યમા અને અનામિકા આંગળી વડે તબલાની શાહીની મધ્યમાં પ્રહાર કરવાથી ‘તી’ બોલ વાગે છે. અને ફરી જમણા હાથની તર્જની આંગળી વડે તબલાની શાહીની મધ્યમાં પ્રહાર કરવાથી ‘ટ’ બોલ વાગે છે. આમ, બંને હાથથી વારાફરતી બોલ વગાડતા ‘ગેગેનિટ’ બોલ વાગે છે.

(2) કડાનધા : સૌપ્રથમ ડાબા હાથના પંજા વડે બાયા પર થાપ મારી તરત જ જમણા હાથની તર્જની આંગળી તબલાના મેદાન (લવ) પર પ્રહાર કરવાથી ‘કડાનુ’ બોલ વાગે છે અને જમણા હાથની તર્જની આંગળી વડે તબલાની કિનારા અને ડાબા હાથની મધ્યમા અને તર્જની આંગળી વડે બાંધા પર એક સાથે પ્રહાર કરવાથી ‘ધા’ બોલ વાગે છે. આમ, બંને હાથથી વારાફરતી બોલ વગાડતા ‘કડાનુ ધા’ બોલ વાગે છે.

(3) નગધેતુ : સૌપ્રથમ જમણા હાથની તર્જની આંગળી વડે તબલાની કિનાર પર પ્રહાર કરવાથી ‘ન’ તેમજ ડાબા હાથની મધ્યમા અને અનામિકા આંગળી વડે બાંધા પર પ્રહાર કરવાથી ‘ગ’, ત્યારબાદ જમણા હાથની મધ્યમા અને અનામિકા આંગળીથી શાહીના મધ્યભાગે અને તેની સાથે બાંધા પર મધ્યમા અને અનામિકા આંગળીથી આધાત કરવાથી ‘ધેતુ’ બોલ વાગે છે. આમ, રીતે વારાફરતી બોલ વગાડવાથી ‘નગધેતુ’ બોલ વાગે છે.

(4) ગદીગન : સૌપ્રથમ ડાબા હાથની મધ્યમા અને અનામિકા આંગળી વડે બાયા પર એક સાથે પ્રહાર કરવાથી ‘ગ’ બોલ વાગે છે. ત્યારબાદ જમણા હાથની તર્જની વડે તબલાની શાહીની એક બાજુ ખુલ્લો પ્રહાર કરવાથી ‘દી’ બોલ વાગે છે. ત્યારબાદ ફરીથી આગળ બતાવ્યા પ્રમાણે ‘ગ’ બોલ વગાડીને તરત જમણા હાથની તર્જની આંગળી વડે તબલાની કિનાર પર પ્રહાર કરવાથી ‘ન’ બોલ વાગે છે. આમ, વારાફરતી બોલ વગાડતા ‘ગદીગન’ બોલ વાગે છે.

(5) ધૂમ કિટક : સૌપ્રથમ જમણા હાથના પંજાથી શાહીની ઉપર આધાત કરીને તેની સાથે જ ડાબા હાથની મધ્યમા અને અનામિકા આંગળી વડે બાંધા પર એકસાથે પ્રહાર કરવાથી ‘ધૂમ’ બોલ વાગે છે. ત્યારબાદ બાંધા પર ડાબા હાથના પંજા વડે થાપ મારી ‘કિ’ બોલ ત્યારબાદ જમણા હાથે તબલા પર મધ્યમા અને અનામિકા આંગળી વડે તબલાની શાહીની મધ્યમાં પ્રહાર કરવાથી ‘ટ’ બોલ તેમજ ફરીથી જમણા હાથની તર્જની આંગળીથી તબલાની શાહીની મધ્યમાં પ્રહાર કરવાથી ‘ત’ બોલ નીકળે છે. ત્યારબાદ જે રીતે ‘કિ’ બોલ નીકળ્યો તે રીતે જ ‘ક’ બોલ વગાડી શકાય છે. આમ, વારાફરતી બધા બોલ વગાડતા ‘ધૂમ કિટક’ બોલ વાગે છે.

(6) કડધેતીટ : સૌપ્રથમ ડાબા હાથના પંજા વડે બાંધા પર થાપ મારી તરત જ જમણા હાથની મધ્યમા અને અનામિકા આંગળીથી તબલાની શાહીની મધ્યમાં થાપ મારવાથી ‘કડ’ બોલ વાગે છે. ત્યારબાદ જમણા હાથની તર્જની આંગળીથી તબલાની શાહીની મધ્યમાં તેમજ સાથે-સાથે ડાબા હાથની મધ્યમા અને અનામિકા આંગળી વડે પર પ્રહાર કરવાથી ‘ધે’ બોલ નીકળે છે. ત્યારબાદ જમણા હાથની મધ્યમા અને અનામિકા આંગળી વડે તબલાની શાહીની મધ્યમાં પ્રહાર કરવાથી ‘તી’ બોલ વાગે છે. અને એ જ જમણા હાથની તર્જની આંગળી વડે તબલાની શાહીની મધ્યમાં પ્રહાર કરવાથી ‘ટ’ બોલ વાગે છે. આમ, આવી રીતે વારાફરતી ઉપરોક્ત બોલ વગાડતાં ‘કડધેતીટ’ બોલ વાગે છે.

સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

- (1) ‘કડાન્દુ’ શબ્દની નિકાસવિધિ જણાવો.
- (2) ‘તીર’ શબ્દની નિકાસવિધિ જણાવો.
- (3) ‘નગધેતુ’ બોલની નિકાસવિધિ જણાવો.
- (4) ‘ધૂમ્રકિટક’ બોલની નિકાસવિધિ જણાવો.

2. સાચા જવાબ સામે ✓ ટીક કરો :

- (1) “એ” શબ્દ બાંધા પર કઈ આંગળીથી વગાડવામાં આવે છે ?
(A) મધ્યમા (B) અનામિકા (C) તર્જની (D) કનિષ્ઠકા
- (2) “દી” શબ્દ તબલા પર કયા સ્થાનમાં વગાડવામાં આવે છે ?
(A) ચાંટી (B) સ્યાહી (C) લવ (D) મૈદાન
- (3) “તિરક્કિટુ”માં “ટ” શબ્દ તબલા પર કઈ આંગળીથી વગાડવામાં આવે છે ?
(A) તર્જની (B) મધ્યમા (C) અનામિકા (D) કનિષ્ઠકા
- (4) “તા” શબ્દ તબલામાં કઈ જગ્યાએ વગાડવામાં આવે છે ?
(A) કિનાર (B) સ્યાહી (C) મૈદાન (D) ગજરો
- (5) “તી” શબ્દ તબલામાં કઈ જગ્યાએ વગાડવામાં આવે છે ?
(A) સ્યાહી (B) કિનાર (C) મૈદાન (D) લવ



પ્રસ્તાવના

સંગીતકલા એ ગુરુમુખી કલા કહેવાય છે માટે સંગીત શીખવા માટે સારા ગુરુ મળે તો જ વિદ્યાર્થી તૈયાર થઈ શકે અને તે માટે વિદ્યાર્થીને અલગ અલગ ધરાનાનો અભ્યાસ કરવો જોઈએ અને દરેક ધરાનાની વિશેષતા એના વાદકોમાં જોવા— સાંભળવા મળતી હોય છે. આ એકમમાં તબલાવાદકોનો પરિચય આપવામાં આવ્યો છે. એના વાંચનથી ધરાનાનો પરિચય કેળવાશે તેમજ કલાકાર કેટલો પરિશ્રમ કરીને એના ફળસ્વરૂપે એમને મળેલ સન્માનથી વિદ્યાર્થીને પ્રોત્સાહન મળશે તેમજ સંગીત તબલાવાદનની કલાના વિકાસ માટેનું તેમનું યોગદાન જેવી મહત્વની બાબતો આ એકમમાંથી પ્રાપ્ત થશે. ગુરુ-શિષ્ય પરંપરાની વિસ્તૃત માહિતી આ એકમમાંથી મેળવી શકશો. અને કલાકારોનું સંગીત ક્ષેત્રમાંમાં તબલા વાદન ઉપરાંત સંગીત નિર્દેશન જેવા પણ કરેલ કાર્યોની માહિતી તથા તબલા વાદનની કલા વિશે લખેલ પુસ્તકોની માહિતી આ એકમ દ્વારા વિદ્યાર્થી મેળવી શકશે.

પંડિત સામતા પ્રસાદ (ગુરુદીપહારાજ)



બનારસ ધરાનાના તબલાસમાટ ‘પ્રતિપુમહારાજ’ના ધરાનાના તબલાવાદકોમાં ગુરુદીપહારાજ એક પ્રસિદ્ધ તબલા વાદક છે. તેમનો જન્મ 27 જુલાઈ, 1921 ના રોજ કલ્યાણાંદ્રા, કાશીમાં થયો. એમની પ્રારંભિક શિક્ષા પિતા પં. બાચાપ્રસાદ મિશ્રથી શરૂ થઈ. પિતાજી પાસે સાત વર્ષ સુધી શિક્ષા મેળવી. ત્યારબાદ પિતાજીનું અવસાન થતાં તબલા શિક્ષા પં બિક્કુજી મિશ્ર પાસેથી લેવાનું શરૂ કર્યું. અત્યંત કઠોર રિયાજથી આપે તબલાવાદનમાં સફળતા પ્રાપ્ત કરી અને સખત પરિશ્રમના ફળસ્વરૂપ આપને અનેક સંગીત સંમેલનોમાં કાર્યક્રમ માટે આમંત્રણ મળવા લાગ્યા. એમણે તબલા સંગત અને તબલાસોલો વાદનના ઉત્તમ કલાકાર તરીકે નામના પ્રાપ્ત કરી. ભારતના અનેક સંગીત સંમેલનોમાં, તેમજ રેઝિયો દૂરરંશન પર અનેક કાર્યક્રમ આપીને નામના પ્રાપ્ત કરી.

એમણે શાસ્ત્રીયસંગીત ઉપરાંત ફિલ્મી સંગીતમાં પણ તબલાવાદનનો પરિચય આપ્યો છે, જેમાં ઝનક ઝનક પાયલ બાજે, બસંત બહાર, શોલે જેવી ફિલ્મોમાં તબલાવાદન કરીને સિનેમા સંગીતને નવો આયામ આપ્યો. આમ જનતાની રસવૃત્તિને પોખણ આપ્યું.

એમને ઘણા પારિતોષિકી આપીને સન્માનિત કર્યા છે જેમાં (1) સન-1979માં સંગીત નાટક અકાદમી એવોર્ડ, (2) સન 1972માં

પદ્મશ્રી એવોર્ડ, (3) 1985માં કલકત્તામાં ‘હાફિઝઅલી’ પુરસ્કાર (4) સન 1991માં ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ‘પદ્મભૂષણ’ એવોર્ડ થી સન્માનિત કર્યા છે.

એમના શિષ્યોમાં શ્રી ભોલેપ્રસાદ સિંહ-પટેના, શ્રી નીતિન ચેટરજી, નભકુમાર, સંખાબક્ષી, સ્વ.ચંદ્રકાન્ત કામત, પ.કુમારલાલ મુખ્ય છે.

ત્રિતાલ, રૂપક, ધમાર અને સવારી આ તાલો આપની પસંદગીના હતા. જેમાં આપે ઘણા તબલા સોલો ના કાર્યક્રમ આપેલ છે.

તેઓ તબલાવાદક તથા ઉત્તમ શિક્ષક પણ હતા. પૂજામાં એક કાર્યશિબિરનું આયોજન કર્યું હતું જેમાં તેઓની તબિયત બગડતાં સન 1994માં 73 વર્ષની ઉંમરે અવસાન થયું.

ઉસ્તાદ અલ્લારખાં



પ્રસિદ્ધ તબલાવાદક અલ્લારખા ખાં નું નામ ભારતના દરેક સંગીતપ્રેમી જાણે છે. આપનો જન્મ 29 એપ્રિલ 1919ના રોજ રતનગઢ (ગુરુદાસપુર)માં થયો. પિતાનું નામ હાશિમ અલી હતું જેઓ ખેતીવાડીનું કામ કરતા હતા.

નાનપણથી તેમને સંગીત પ્રત્યે ખૂબ જ લગાવ હતો. 15 વર્ષની ઉંમરમાં પઠાનકોટની એક નાટક કંપનીમાં નોકરી મેળવી. નોકરીમાં એમને તબલાના મહાન ઉસ્તાદ કાદિરબક્ષના શિષ્યખાં સાહેબ લાલમુહમ્મદનો પરિચય થયો અને આપે એમની પાસે તબલાની શિક્ષા લેવાનું શરૂ કર્યું.

કેટલાક સમય બાદ કાકાની સાથે આપને લાહોર જવાનું થયું. ત્યાં આપે ઉ.કાદિરબક્ષ પાસે થી તબલાની શિક્ષા પ્રાપ્ત કરી. અથાગ પરિશ્રમથી એમણે તબલાવાદનની શિક્ષા પ્રાપ્ત કરીને પંજાਬ ધરાનાનું નામ રોશન કર્યું.

એમણે તબલાવાદનની સાથે ગાવાની પણ તાલીમ પત્તિયાલા ધરાનાના ગાયક ઉ. આશિકઅલી પાસે મેળવી હતી.

લાહોર અને દિલ્હી આકાશવાણી કેન્દ્રો પર તબલાવાદનના કાર્યક્રમ પ્રસારિત કર્યા બાદ સન 1940માં ઓલ ઇન્ડિયા રેડિયો મુંબઈમાં સ્ટાફ આર્ટિસ્ટ તરીકે નોકરી મળી. મુંબઈમાં થોડો સમય નોકરી કર્યા બાદ એ નોકરી છોડી દીધી અને સ્વતંત્ર પ્રોગામ આપવાના શરૂ કર્યા. આપે ઘણા ઉસ્તાદો સાથે તબલાં સંગત કરી છે, જેમાં ઉ.બડેગુલામ અલી, અલ્લાઉદીનખાં, ઉ. વિલાયતખા, શ્રી વસંત રાહી, ઉ. અલી અકબરખાં, પ.રવિશંકર મુખ્ય છે.

એમણે ફિલ્મી સંગીતમાં પણ 1943થી 1948 સુધી સંગીત નિર્દેશનનું કાર્ય કરેલ છે.

તેમના તબલાવાદનમાં પંજાબ ઘરાનાની વિશેષતાઓ જોવા મળે છે. ગાયન તેમજ તંત્રકારોની સંગતમાં તેઓએ ખૂબ જ નામના પ્રાપ્ત કરી છે.

એમના શિષ્યોમાં શ્રી યોગેશ સમશી, શ્રી આદિત્ય કલ્યાણપુર, અનુરાધા પાલ, નીશીકાંત બરોડેકર, શ્રી ઉદ્ય રામદાસ, તૌફિક કુરેશી, ફરુલ કુરેશી, ઉ.જાકિરહુસેન મુખ્ય છે.

એમને સન 1977માં પચશ્શીનો એવોઈ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રાપ્ત થયો તથા સન 1982માં સંગીત નાટક અકાદમી દ્વારા એવોઈ પ્રાપ્ત થયો.

સન 2000ના 3 ફેબ્રુઆરીના દિવસે મુંબઈમાં ટૂંકી માંદગીમાં આ દુનિયા છોડી, આજે પણ તેઓની કલા અમર છે.

ડૉ. આબાન મિસ્ટ્રી



ભારતના સૌપ્રथમ મહિલા તબલાવાદક તરીકે ડૉ. આબાન મિસ્ટ્રીનું નામ આદરપૂર્વક લેવામાં આવે છે.

ડૉ. આબાન મિસ્ટ્રીનો જન્મ તા. 6-5-1940ના રોજ અલીગઢમાં થયો હતો. સ્વભાવના ખૂબ જ શાંત અને નિર્મળ હતા. એમણે નાનપણથી જ સંગીતની તાલીમ પંડિત કે.કી જીજના પાસેથી લેવાની શરૂ કરી. આપે ગાયન, સિતાર અને તબલાની શિક્ષા લીધી બાદ કથ્થક નૃત્યની શિક્ષા લેવાનું શરૂ કર્યું પરંતુ તબિયત નાદુરસ્ત હોવાથી કથ્થકનો અભ્યાસ છોડવો પડ્યો.

ડૉ. આબાનજીએ ત્યારબાદ ઉ. અમીરહુસેન ખાં પાસે તબલાની ઉચ્ચ શિક્ષા લેવાનું શરૂ કર્યું અને વર્ષો સુધી રિયાઝ અને રસપૂર્વક તબલાની શિક્ષા ગ્રહણ કરી. એક મહિલા તબલાવાદક તરીકેનો પડકાર જીલીને દેશના ઘણા સંગીત સંમેલનોમાં તબલાસોલો વાદનના કાર્યક્રમ રજૂ કરીને નામના પ્રાપ્ત કરી.

ડૉ. આબાનજીએ ‘સ્વર સાધના સમિતિ’ નામક સંસ્થાની સ્થાપના મુંબઈમાં ફરી અને એમાં સંગીત, ગાયન, વાદન, તબલાનું શિક્ષણ આપવાનું શરૂ કર્યું. તેમજ સંગીતસ્પર્ધાનું આયોજન કરીને દેશના ઉગતા કલાકારોને પ્રોત્સાહન આપતા. આમ સંગીતનો સતત વિકાસ થાય. તબલાનો વિકાસ થાય એવા વિચારો સતત આવતા અને પોતાનાથી બનતું બધું જ કરતા. સંગીત

માસિક પત્રિકાઓ શરૂ કરી, જેમાં સંગીત વિષયક-જુદા જુદા કલાકારોના લેખ આવતા. આમ, સમાજ ઉપયોગી કાર્ય પણ કર્યું છે. તબલા વિષય પર-પખાવાજ, તબલે કી બંદીશે, જેવા પુસ્તકો લખીને સંગીતના વિદ્યાર્થીઓ માટે ઉત્તમ કાર્ય કરેલ છે.

આવા મહાન તબલાવાદક તા. 30-9-2012ના રોજ મુંબઈમાં અવસાન થયું. આજે પણ તેમના પ્રદાનથી સંગીતની દુનિયા સમૃદ્ધ છે.

સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના જવાબ આપો :

- (1) ઢ.અલ્લારખાનો જન્મ સાલમાં થયો હતો.
- (2) પંડિત યોગેશ સમશી ના શિષ્ય છે.
- (3) સાલમાં ઢ.અલ્લારખા ખાંને પદ્મશ્રીનો એવોઈ મળ્યો હતો.
- (4) પં. સામતાપ્રસાદ નામથી પ્રસિદ્ધ હતા.
- (5) દેશના સૌપ્રથમ ભહિલા તબલાવાદક હતા.
- (6) ડૉ. આબાન મિસ્નીનો જન્મ સાલમાં થયો હતો.

2. સાચા જવાબ સામે ✓ ટીક કરો :

- (1) પં. સામતા પ્રસાદ ક્યા ઘરાનાના તબલા વાદક છે ?
(A) દિલ્હી ઘરાના (B) લખનાઉ ઘરાના
(C) બનારસ ઘરાના (D) પંજાબ ઘરાના
- (2) ઢ. અલ્લારખાં ક્યા ઘરાનાના તબલા વાદક છે ?
(A) ફરુખાબાદ (B) પંજાબ
(C) દિલ્હી (D) અજરાડા
- (3) ડૉ. આબાન મિસ્ની ક્યાં રહીને તબલાનો વિકાસ કર્યો ?
(A) અલગીઠ (B) દિલ્હી
(C) મુંબઈ (D) અમદાવાદ



વિભાગ 2 (કિયાત્મક)

1

તાલ-પરિચય

પ્રસ્તાવના

સંગીતમાં સ્વર અને તાલ ખૂબ જ મહત્વ ધરાવે છે. તબલાના વિદ્યાર્થીઓને અલગ અલગ માત્રાના તાલોની જાણકારી મેળવવી જરૂરી છે. જે આ એકમમાં જુદી જુદી માત્રાના તાલો દ્વારા જાણકારી પ્રાપ્ત થશે. તાલની જાણકારી સાથે સાથે એ તાલ કઈ ગાયન શૈલીમાં સંગત માટે ઉપયોગી થશે તેની વિશેષ જાણકારી આપવામાં આવી છે તેમજ દરેક તાલમાં આવતા બોલ દ્વારા ખબર પડશે કે આ તાલ ખુલ્લાબાજ એટલે કે પખાવજ પર વગાડવામાં આવે છે કે બંધબાજ એટલે કે તબલા પર વગાડવામાં આવે છે. આ બધી જ માહિતી આ એકમ દ્વારા મેળવી શકશો. તાલને અલગ અલગ લયમાં કેવી રીતે લખવા તે જાણવું ખૂબ જ જરૂરી છે. એક માત્રામાં બે બોલ આવે તો દુગુન, ત્રણ બોલ આવે તો ત્રણુન, ચાર બોલ આવે તો ચૌગુન લય થાય. તો એ લયમાં આખો તાલ કેવી રીતે લખવામાં આવશે તેની જાણકારી આ એકમથી મેળવી શકશો. અને લયનું જ્ઞાન પ્રાપ્ત થશે.

કિયાત્મક

એકમ 1

અભ્યાસક્રમના તાલોને માહિતી સાથે લિપિબદ્ધ કરી. દુગુન અને ચૌગુન લય કારી સાથે લખવાનો અભ્યાસ.

તાલ : એકતાલ, રૂપક, ચૌતાલ, દીપચંદી.

(1) તાલ - એકતાલ

માહિતી :

આ તાલ ખ્યાલ અંગની ગાયકીમાં સાથસંગત કરવા માટે ખૂબ પ્રચલિત તાલ છે. આ તાલની રચના ખ્યાલ અંગની ગાયકીના જન્મ સાથે થઈ હશે. આ તાલને વિલંબિતલય, મધ્યલય તથા હૃતલય આ ગણે લયમાં ખૂબ જ સુંદરતાથી વગાડી શકાય છે. આ તાલમાં પેશકાર, કાયદા, ટુકડા, રેલા, પરન વગેરે વગાડી શકાય છે. આ તાલ સોલોવાદન અને સંગતમાં ઉપયોગી તાલ છે. આ તાલ બંધબાજમાં વગાડવામાં આવે છે.

માત્રા-12, વિભાગ-6, તાલી-1, 5, 9, 12 માત્રા 52, ખાલી-3, 7 માત્રા 42.

મૂળ લય :

1	2	3	4	5	6	7	8	9	10	11	12	1
ધી	ધી	ધાગે	તિરક્કિટ	તું	ના	ક	તા	ધાગે	તિરક્કિટ	ધી	ના	ધી
X		0		2		0		3		4		X

દુગુન લય :

1	2	3	4	5	6	7	8	9	10	11	12	1
ધીધી	ધાગે	તિરક્કિટ	તુંના	કતા	ધાગેતિરક્કિટ	ધીના	ધીધી	ધાગેતિરક્કિટ	તુંના	કતા	ધાગેતિરક્કિટ	ધીના
X		0		2		0		3		4		X

● यौगुन लय :

1 धींधींधागेतिरक्ट	2 तूना कता	3 धागेतिरक्टधींना	4 धींधींधागेतिरक्ट	5 तूनाकता	6 धागेतिरक्टधींना	
X 7 धींधींधागेतिरक्ट	8 तूना कता	0 9 धागेतिरक्टधींना	10 धींधींधागेतिरक्ट	2 11 तूनाकता	12 धागेतिरक्टधींना	
0		3		4		
						X

(2) ताल-उपक

माहिती :

आ तबलानो ताल छे. आ तालनो उपयोग सोलोवादनमां ख्याल अंगनी गायकीमां तथा वाद संगीत जेवा के सितार, वायोलिन वगेरेनी गतोमां संगत करवामां थाय छे. आजकाल भजनसंगीत, गङ्गल, तथा तेमજ भावसंगीत जेवा प्रकारोमां संगत करवामां उपयोगी ताल मानवामां आवे छे. सोलोवादनमां पेशकार, कायदा, टुकडा, रेला, परन वगेरे आ तालमां वगाडवामां आवे छे. आ तालमां शास्त्रना नियम प्रमाणे खाली आवती नथी परंतु क्षियात्मक दृष्टिथी आ तालनी शरुआत 'ती' शब्दथी थाय छे ऐटले लोकी वधु भागे खाली माने छे ऐटले आ तालनी पहेली मात्रा पर ताली अने खाली बनेना चिह्न करवामां आवे छे.

सिंगल लय :

मात्रा-7 विभाग-3 ताली : 1, 4, 6 मात्रा पर.

1 ती ⊗	2 ती ⊗	3 ना	4 धी 2	5 ना	6 धी 3	7 ना	1 ती ⊗
--------------	--------------	---------	--------------	---------	--------------	---------	--------------

दुगुन लय :

1 तींती ⊗	2 नाधी ⊗	3 नाधी	4 ना, ती 2	5 तींना	6 धींना	7 धींना	1 ती X
-----------------	----------------	-----------	------------------	------------	------------	------------	--------------

यौगुन लय :

1 तींतींनाधी ⊗	2 नाधींनाति	3 तिनाधीना	4 धींना, तींती 2	5 नाधींनाधी	6 नातींतींना	7 धींनाधीना	1 ती ⊗
----------------------	----------------	---------------	------------------------	----------------	-----------------	----------------	--------------

नोंध : आ ताल बंधबाजमां वगाडवामां आवे छे.

(3) તાલ-ચૌતાલ

માહિતી :

ચારતાલ અથવા ચૌતાલ પખાવજ વાધનો મુખ્ય તાલ માનવામાં આવે છે. આ તાલનો ઉપયોગ દ્વારા અંગની ગાયકીમાં સંગત કરવામાં આવે છે. આ તાલની તાલી, ખાલી તથા વિભાગ એકતાલની જેમ સરખી છે. આ તાલમાં પખાવજ પર સોલોવાદન પણ કરવામાં આવે છે. આ તાલના બોલ ખુલ્લા અને જોરદાર છે. આ તાલમાં પરન, રેલ, તિહાઈ વગેરે વગાડવામાં આવે છે.

માત્રા-12, વિભાગ-6, તાલી-1, 5, 9, 11 માત્રા પર ખાલી-3, 7 માત્રા પર.

સિંગલ લય :

1	2	3	4	5	6	7	8	9	10	11	12	1
ધા	ધા	દિં	તા	કિટ	ધા	દિં	તા	તિટ	કિટ	ગાદિ	ગન્ન	ધા
X		0		2		0		3		4		X

દુગુન લય :

1	2	3	4	5	6	7	8	9	10	11	12	1
ધાધા	દિંતા	કિટધા	દિંતા	તિટકત	ગાદિગન	ધાધા	દિંતા	કિટધા	દિંતા	તિટકત	ગાદિગન	ધા
X		0		2		0		3		4		X

ચૌગુન લય :

1	2	3	4	5	6		
ધાધાદિંતા	કિટધાદિંતા	તિટકતાગાદિગન	ધાધાદિંતા	કિટધાદિંતા	તિટકતાગાદિગન		
X		0		2	0		
7	8	9	10	11	12		
ધાધાદિંતા	કિટધાદિંતા	તિટકતાગાદિગન	ધાધાદિંતા	કિટધાદિંતા	તિટકતાગાદિગન		
0		3		4			

(4) તાલ-દીપચંદી

માહિતી :

આ તાલનો ઉપયોગ હુમરી ગાયન તથા હોરી, ચૈતી, કજરી વગેરે ગાયનપ્રકારોમાં સંગત કરવામાં આવે છે. આ તાલમાં સોલોવાદન કરવામાં આવતું નથી એટલે આ તાલમાં પેશકાર, કાયદા, પરન વગેરે વગાડવામાં આવતા નથી પરંતુ નાના-નાના બોલોના મોહરા, મુખડાનો જ ક્યારેક ઉપયોગ કરવામાં આવે છે. આ તાલનો પ્રયોગ મધ્યલયમાં જ કરવામાં આવે છે. આ તાલ બંધબાજમાં વગાડવામાં આવે છે.

માત્રા-14, વિભાગ-4, તાલી-1, 4, 11 માત્રા પર, ખાલી-8 માત્રા પર.

સિગલ લય :

1	2	3	4	5	6	7	8	9	10	11	12	13	14	1
ધા	ધી	ઝ	ધા	ધા	તી	ઝ	તા	તી	ઝ	ધા	ધા	ધી	ઝ	ધા
X			2				0			3				X

હુગુન લય :

1	2	3	4	5	6	7	8	9	10	11	12	13	14	1
ધાધી	ડધા	ધાતી	ડતા	તીંડ	ધાધા	ધીડ	ધાધિ	ડધા	ધાતી	ડતા	તીંડ	ધાધા	ધીડ	ધા
X			2				0			3				X

ચૌગુન લય :

1	2	3	4	5	6	7	
ધાધીડધા	ધાતીડતા	તીડધાધા	ધીડધાધી	ડધાધાતી	ડતાતીડ	ધાધાધીડ	
X			2				
8	9	10	11	12	13	14	1
ધાધીડધા	ધાતીડતા	તીડધાધા	ધીડ, ધાધી	ડધાધાતી	ડતાતીડ	ધાધાધીડ	ધા
0			3				X

સ્વાધ્યાય

1. પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો :

- (1) તાલ એકતાલનો ઉપયોગ કઈ ગાયકીમાં વધુ થાય છે ?
- (2) તાલ એકતાલમાં કેટલી તાલી અને કેટલી ખાલી આવે છે ?
- (3) તાલ રૂપકમાં બે-બે માત્રાના કેટલા વિભાગ છે ?
- (4) તાલ ચૌતાલને કયા વાદ પર વગાડવામાં આવે છે ?
- (5) તાલ ચૌતાલમાં કયા બાજનાં બોલ વગાડવામાં આવે છે ?
- (6) તાલ દીપચંદીની કેટલી માત્રા છે ?
- (7) તાલ દીપચંદીનો ઉપયોગ કઈ ગાયકીમાં વધુ થાય છે ?
- (8) ખુલ્લા બાજમાં કયો તાલ વગાડવામાં આવે છે ?
- (9) તાલ રૂપક કયા બાજમાં વગાડવામાં આવે છે ?

2. સાચા જવાબ સામે ✓ ટીક કરો :

- (1) એકતાલની માત્રા કેટલી છે ?
(A) 10 (B) 12 (C) 7 (D) 14
- (2) ભજન, ભાવગીત, ગજલમાં ક્યા તાલની સંગત થાય છે ?
(A) એકતાલ (B) રૂપક (C) ચૌતાલ (D) દિપચંદી
- (3) ધ્રુપદ અંગની ગાયકીમાં ક્યા તાલનો ઉપયોગ થાય છે ?
(A) રૂપક (B) એકતાલ (C) દિપચંદી (D) ચૌતાલ
- (4) ક્યા તાલમાં સોલોવાદન કરવામાં આવતું નથી ?
(A) એકતાલ (B) રૂપક (C) ચૌતાલ (D) કહેરવા



પ્રસ્તાવના

આ એકમમાં કિયાત્મક રીતે તિશ્રજ્ઞતિના કાયદાની જાણકારી પ્રાપ્ત થશે. એક માત્રામાં ત્રણ બોલ લેવાથી તિશ્રજ્ઞતિની જાણકારી કેળવાશે, એવી જ રીતે તિશ્રજ્ઞતિના કાયદાની હુગુન થવાથી છગુની લયની સમજ કેળવાશે. આ કાયદાને વિવિધ પ્રકારે કેવી રીતે વગાડવા તેની સમજ પલટા દ્વારા પ્રાપ્ત થશે. એ કાયદાને કેવી રીતે પૂર્ણ થશે. તેની સમજ તિહાઈ દ્વારા મેળવશે. સમની સમજ કેળવવા માટે સમ આવતાં પહેલાં નાના પ્રકારના બોલ વગાડીને મુખડાની સમજ કેળવાય તેમજ નાના પ્રકારના બોલનો વિસ્તાર કરીને મોટા સ્વરૂપની જાણકારી ટુકડા દ્વારા પ્રાપ્ત થાય એ વિશે જ્ઞાનની સમજ આ એકમ દ્વારા કેળવાશે. દરેક કાયદા, પલટા, તિહાઈ, મુખડા, ટુકડા, રેલા, ચકદાર બધા જ પ્રકારોમાં બોલની વિશેષતા શું છે તે આ એકમ દ્વારા પ્રાપ્ત થશે.

ત્રિતાલમાં તિસ્ત્ર જાતિનો કાયદો

ધારેન X	ધાત્રક	ધેટેટ	ધારેન	
ધાત્રક 2	ધેટેટ	ગીનતી	નાકીન	
તાકેન 0	તાત્રક	તેટેટ	તાકેન	
ધાત્રક 3	ધેટેટ	ગેનધી	નાગીન	ધા X

હુગુન

ધારેનધાત્રક X	ધેટેટ ધારેન	ધાત્રકધેટેટ	ગીનતીનાકીના	
તાકેનતાત્રક 2	તેટેટતાકેન	ધાત્રકધેટેટ	ગીનધીનાગીના	
ધારેનધાત્રક 0	ધેટેટધારેન	ધાત્રકધેટેટ	ગીનતીનાકીના	
તાકેનતાત્રક 3	તેટેટતાકેન	ધાત્રકધેટેટ	ગીનધીનાગીન	ધા X

પલટા નં. 1

<u>ધારોનધારક</u>	<u>ધેતેટધાગેન</u>	<u>ધારોનધારક</u>	<u>ધેતેટધાગેન</u>
X			
ધારોનધારક	<u>ધેતેટધાગેન</u>	<u>ધારોનધારક</u>	<u>ગીનતીનાકીના</u>
2			
તાકેનતાત્ત્વક	<u>તેતેટતાકેન</u>	<u>તાકેનતાત્ત્વક</u>	<u>તેતેટતાકેન</u>
0			
ધારોનધારક	<u>ધેતેટધાગેન</u>	<u>ધારોનધારક</u>	<u>ગીનધીનાગીના</u>
3			

પલટા નં. 2

<u>ધારોનધારક</u>	<u>ધેતેટધાગેન</u>	<u>ધેતેટધાગેન</u>	<u>ધેતેટધાગેન</u>
X			
ધારોનધારક	<u>ધેતેટધાગેન</u>	<u>ધારોનધારક</u>	<u>ગીનતીનાકીના</u>
2			
તાકેનતાત્ત્વક	<u>તેતેટતાકેન</u>	<u>તેતેટતાકેન</u>	<u>તેતેટતાકેન</u>
0			
ધારોનધારક	<u>ધેતેટધાગેન</u>	<u>ધારોનધારક</u>	<u>ગીનધીનાગીના</u>
3			

પલટા નં. 3

<u>ધારોનધારક</u>	<u>ધેતેટધાગેન</u>	<u>ધાડકડક</u>	<u>ધેતેટધાગેન</u>
X			
ધારોનધારક	<u>ધેતેટધાગેન</u>	<u>ધારોનધારક</u>	<u>ગીનતીનાકીના</u>
2			
તાકેનતાત્ત્વક	<u>તેતેટતાકેન</u>	<u>તાકેનતાત્ત્વક</u>	<u>તેટેટતાકેન</u>
0			
ધારોનધારક	<u>ધેતેટધાગેન</u>	<u>ધારોનધારક</u>	<u>ગીનધીનાગીન</u>
3			

નિહાઈ

<u>ધાગેનધાત્રક</u>	<u>ધેટધાગેન</u>	<u>ધાત્રકધેટ</u>	<u>ગીનતીનાકીન</u>	
X				
<u>ધાડડડડડ</u>	<u>ધેટધાગેન</u>	<u>ધાગેનધાત્રક</u>	<u>ધેટધાગેન</u>	
2				
<u>ધાત્રકધેટ</u>	<u>ગીનતીનાકીના</u>	<u>ધડડડડ</u>	<u>ધેટધાગેન</u>	
0				
<u>ધાગેનધાત્રક</u>	<u>ધેટધાગેન</u>	<u>ધાત્રકધેટ</u>	<u>ગીનતીતાકીના</u>	ધા
3				X

ન્રિતાલમાં બે મુખડા

(1)

ધા	ધી	ધી	ધા	
X				
ધા	ધી	ધી	ધા	
2				
ધા	તી	તી	તા	
0				
<u>તકતીના</u>	<u>કીટતકતા-તીર</u>	<u>કીટતકતીરકીટ</u>	<u>તકતા-તીરકીટ</u>	ધા
3				X

(2)

ધા	ધી	ધી	ધા	
X				
ધા	ધી	ધી	ધા	
2				
ધા	તી	તી	તા	
0				
<u>ધા-તીરકીટતક</u>	<u>તા-તીરકીટતક</u>	<u>તીરકીટતકતા-</u>	<u>તીરકીટધાતી</u>	ધા
3				X

ત्रितालमાં બે ટુકડા

(1)

<u>ધાડધાડ</u>	<u>દીડદીડ</u>	<u>નાડનાડ</u>	<u>તીટતીટ</u>	
X				
<u>કટીટધા</u>	<u>તીટકટ</u>	<u>ધાડકટ</u>	<u>ધાડકટ</u>	
2				
<u>ધાડિડ</u>	<u>રડકટ</u>	<u>ધાડકટ</u>	<u>ધાડકટ</u>	
0				
<u>ધાડિડ</u>	<u>રડકટ</u>	<u>ધાડકટ</u>	<u>ધાડકટ</u>	
3				
				ધા X

(2)

<u>ધેતધેત</u>	<u>તીટતીટ</u>	<u>તીટતીટ</u>	<u>ધીડતીટ</u>	
X				
<u>કટીટધા</u>	<u>અનધાડ</u>	<u>તીટકટા</u>	<u>ગાઈગાન</u>	
2				
<u>કટધાડ</u>	<u>નધાડન</u>	<u>ધાડડડ</u>	<u>કટધાડ</u>	
0				
<u>નધાડન</u>	<u>ધાડડડ</u>	<u>કટધાડ</u>	<u>નધાડન</u>	
3				
				ધા X

ત્રિતાલમાં બે રેલા

(1)

<u>ધાડતીર</u>	<u>કીટતક</u>	<u>ધીરધીર</u>	<u>કીટતક</u>	
X				
<u>ધાડતીર</u>	<u>કીટતક</u>	<u>તાડતીર</u>	<u>કીટતક</u>	
2				
<u>તાડતીર</u>	<u>કીટતક</u>	<u>તીરતીર</u>	<u>કીટતક</u>	
0				
<u>ધાડતીર</u>	<u>કીટતક</u>	<u>ધાડતીર</u>	<u>કીટતક</u>	
3				
				ધા X

ન્રિતાલમાં રેલા નં. 2

<u>ધાડતીર</u>	<u>કીટતક</u>	<u>તીરકીટ</u>	<u>ધાડતીર</u>	ધા X
X				
<u>કીટતક</u>	<u>ધાડતીર</u>	<u>કીટતક</u>	<u>તીરકીટ</u>	
2				
<u>તાડતીર</u>	<u>કીટતક</u>	<u>તીરકીટ</u>	<u>તાડતીર</u>	
0				
<u>કીટતક</u>	<u>ધાડતીર</u>	<u>કીટતક</u>	<u>તીરકીટ</u>	
3				

ન્રિતાલમાં એક ચકધાર

<u>ધાડધાડ</u>	<u>દીડદીડ</u>	<u>નાડનાડ</u>	<u>તીટતીટ</u>	ધા X
X				
<u>કતીટધા</u>	<u>તીટકત</u>	<u>કતીટધા</u>	<u>તીટકત</u>	
2				
<u>કતીટધા</u>	<u>તીટકત</u>	<u>ધા</u>	<u>ધાડધાડ</u>	
0				
<u>દીડદીડ</u>	<u>નાડનાડ</u>	<u>તીટતીટ</u>	<u>કતીટધા</u>	
3				
<u>તીટકત</u>	<u>કતીટધા</u>	<u>તીટકત</u>	<u>કતીટધા</u>	
X				
<u>તીટકત</u>	<u>ધા</u>	<u>ધાડધાડ</u>	<u>દીડદીડ</u>	
2				
<u>નાડનાડ</u>	<u>તીટતીટ</u>	<u>કતીટધા</u>	<u>તીટકત</u>	
0				
<u>કતીટધા</u>	<u>તીટકત</u>	<u>કતીટધા</u>	<u>તીટકત</u>	
3				

સ્વાધ્યાય

1. જવાબ લખો :

- (1) ન્રિતાલમાં તિથાતિનો કાયદો લખો.
- (2) ન્રિતાલમાં મુખું લિપિબદ્ધ કરો.
- (3) ન્રિતાલમાં ચકધાર લિપિબદ્ધ કરો.
- (4) ન્રિતાલમાં ટુકડો લિપિબદ્ધ કરો.



પ્રસ્તાવના

તાલ એકતાલમાં કાયદાનું સ્વરૂપ કેવું હોય તેની સમજ આ એકમમાં આપેલ કાયદા દ્વારા પ્રાપ્ત થશે અને કાયદાને વિવિધ પ્રકારે કેવી રીતે વગાડવા તેની જાણકારી વિવિધ પલટા દ્વારા પ્રાપ્ત થશે. કાયદાને પૂર્ણ કરતી વખતે શું કરવું તેની જાણકારી તિહાઈ દ્વારા વિદ્યાર્થી મેળવશે. નાના બોલનો ઉપયોગ કરી સમ પર કેવી રીતે આવવું તેની માહિતી મુખડા દ્વારા પ્રાપ્ત થશે.

એકતાલમાં એક કાયદો જાણ પલટા તિહાઈ સાથે, બે મુખડા, બે ટુકડા વગાડવાની ક્ષમતા.

તાલ એકતાલ

મૂળ લયમાં

ગીના	તીટ		ગીના	ધાર્ગે		ઘિના	ગિના		ધાતિ	ટધા		ગેના	ધાર્ગે		તિના	કિના		
X			0			2			0			3			4			1
કિના	તિટ		કીના	તાકે		તિના	કિના		ધાતિ	ટધા		ગેના	ધાર્ગે		ઘિના	ગીના		
X			0			2			0			3			4			ધી

કાયદો દુઃખુન લયમાં

ગીનાતીટ	ગીનાધાર્ગે		ઘિનાગીના		ધાતીટધા		ગેનાધાર્ગે		તિનાકિના									1	
X			0																
કિનાતીટ	કિનાતાકે		તિનાકિના		ધાતીટધા		ગેનાધાર્ગે		ઘિનાગીના									ધી	
0			3																X

પલટો 1

ગીનાતીટ	ગીનાધાર્ગે		ઘિનાગીના		ગીનાતીટ		ગીનાધાર્ગે		ઘિનાગીના										
X			0																
ગીનાતીટ	ગીનાધાર્ગે		ઘિનાગીના		ધાતીટધા		ગેનાધાર્ગે		તિનાકિના										
0			3																
કિનાતીટ	કિનાતાકે		તિનાકિના		કિનાતિટ		કિનાતાકે		તિનાકિના										
X			0																
ગીનાતિટ	ગીનાધાર્ગે		ઘિનાગીના		ધાતીટધા		ગેનાધાર્ગે		ઘિનાગીના										
0			3																

પલટો 2

ગીનાતીટ	ગીનાધાર્ગે		ઘિનાગીના		ધાતીટધા		ગેનાધાર્ગે		ઘિનાગીના										
X			0																
ધાતીટધા	ગેનાધાર્ગે		ઘિનાગીના		ધાતીટધા		ગેનાધાર્ગે		તિનાકિના										
0			3																

<u>કનાતિટ</u>	<u>કિનાતાકે</u>	<u>તિનાકિના</u>	<u>તાતીટતા</u>	<u>કેનાતાકે</u>	<u>તિનાકિના</u>
X		0		2	
ધાતીટથા	ગેનાધારો	ઘિનાગીના	ધાતીટથા	ગેનાધારો	ઘિનાગીના
0		3		4	

પલટો 3

<u>ગ્રાનાતિટ</u>	<u>ગેનાધારો</u>	<u>ઘિનાગીના</u>	<u>ધાતીટથા</u>	<u>ગેનાધારો</u>	<u>ઘિનાગીના</u>
X		0		2	
તિટતિટ	ગેનાધારો	ઘિનાગીના	ધાતીટથા	ગેનાધારો	તિનાકિના
0		3		4	
<u>કનાતિટ</u>	<u>કિનાતાકે</u>	<u>તિનાકિના</u>	<u>તાતીટતા</u>	<u>કેનાતાકે</u>	<u>તિનાકિના</u>
X		0		2	
<u>તિટતિટ</u>	<u>ગેનાધારો</u>	<u>ઘિનાગીના</u>	<u>ધાતીરથા</u>	<u>ગેનાધારો</u>	<u>ઘિનાગીના</u>
0		3		4	

તિહાઈ-1

<u>ગ્રાનાતિટ</u>	<u>ગેનાધારો</u>	<u>ઘિનાગીના</u>	<u>ધ----</u>	<u>--ગ્રાના</u>	<u>તિટગ્રાના</u>
X		0		2	
ધારોઘિના	ગ્રાનાધાર	ઘિનાગ	ગ્રાનાતિટ	ગ્રાનાધારો	ઘિનાગીના
0		3		4	

તિહાઈ-2

<u>ગ્રાનાતિટ</u>	<u>ગેનાધારો</u>	<u>ઘિનાગીના</u>	<u>ધાતીટથા</u>	<u>ગેનાધારો</u>	<u>ઘિનાગીના</u>
X		0		2	
ધાડડડ	ગેનાધારો	ઘિનાગીના	ધાડડડ	ગેનાધારો	ઘિનાગીના
0		3		4	

મુખડા-1

ધી	ધી	ધારો	તિરક્કિટ	તુ	ના	કુ	તા	તિરક્કિટ	તકતા	તિરક્કિટ	ધાતી	ધી
X		0		2		0		3		4		X

મુખડા-2

ધી	ધી		ધારો	તિરક્કટ		તું	ના		તિરક્કટ	તકતા		તિરક્કટ	ધાતિ		ધાડ	ધાતિ		ધી
X			0			2			0			3			4			X

ટુકડા-1

કટતિટ	ધેઘેતિટ		કટકત	ધેઘેતિટ		કટધેઘે	તિટકત		ધાડકત	ધાડડડ									।
X			0						0										

ટુકડા-2

ધાતીટથા	તિટથાધા		તિટકથા	તિટથારો		દિંદિં	નગનગ		તુંનાકિટક	કટધા									
X			0						0										

સ્વાધ્યાય

1. જવાબ લખો :

- . (1) એકતાલ લિપિબદ્ધ કરી તેની દુગુન લિપિબદ્ધ કરો.
- (2) એકતાલમાં એક કાયદો લિપિબદ્ધ કરો.
- (3) એકતાલમાં એક ટુકડો લિપિબદ્ધ કરો.
- (4) એકતાલમાં એક મુખડો લિપિબદ્ધ કરો.
- (5) એકતાલમાં એક કાયદો જાતે બનાવી લખો.
- (6) એકતાલમાં બે ટુકડા જાતે બનાવો.
- (7) એકતાલમાં બે માત્રાના બે મુખડા લખો.



પ્રસ્તાવના

સંગીતમાં શાસ્ત્રીય સંગીત અને ઉપશાસ્ત્રીય સંગીત એવા બે વિભાગ જોવા મળે છે. શાસ્ત્રીય સંગીતમાં વગાડવામાં તાલ અને ઉપશાસ્ત્રીય સંગીતમાં વગાડવામાં આવતા તાલમાં બિન્નતા જોવા મળે છે. શાસ્ત્રીય સંગીતમાં ત્રિતાલ, એકતાલ, ઝપતાલ, રૂપક, આડાચૌતાલ વગેરે તાલોનો પ્રયોગ થાય છે. જ્યારે ઉપશાસ્ત્રીય સંગીત માં દાદારા, કહરવા, દીપયંદી, ધૂમાળી, વગેરે તાલોનો પ્રયોગ થાય છે. ઉપશાસ્ત્રીય સંગીતમાં ગવાતી ગાયનશૈલી મુખ્યત્વે આવે છે ત્યારે આ ગાયનશૈલીમાં વગાડવામાં આવતા તાલને વિશિષ્ટ રીતે ૨જૂ કરવા માટે વિવિધ બોલોના સહાયથી તાલના પ્રકાર અને લગ્નીઓનો પ્રયોગ કરવામાં આવે છે.

તાલ કહરવા અને દાદારામાં બે પ્રકાર અને બે લગ્ની વગાડવાનું જ્ઞાન

તાલ-કહરવા

માત્રા-8, ખંડ-2, તાલી-1 ખાલી-5 માત્રાપર જાતિ-અતુલ બાજ-બંધબાજ

1	2	3	4		5	6	7	8	1
ધા	ગો	ના	તી		ના	કૃ	ધી	ના	ધા
X					0				X

પ્રકાર

(1)	1	2	3	4	5	6	7	8	1
	ધા	ધાગો	ના	નાતી	ના	નાકે	ધી	નાના	ધા
	X				0				X
(2)	1	2	3	4	5	6	7	8	1
	ધા	તિરક્કટ	ધાગો	નાતી	ના	તિરક્કટ	ધાગો	ધાના	ધા
	X				0				X

લગ્ની-

(1)	1	2	3	4	5	6	7	8	1
	ધાગો	નધા	તિરક્કટ	તીના	તાકે	નધા	તિરક્કટ	ધેના	ધા
	X				0				X
(2)	1	2	3	4	5	6	7	8	1
	ધાતી	ધાગો	તીના	કીના	તાતી	ધાગો	ધીના	ગીના	ધા
	X				0				X

તાલુદાદરા

માત્રા-6 ખંડ-2, તાલી-1, ખાલી-4 માત્રાપર જાતિ-તિસ્ત્ર બાજ-બંધબાજ

1 ધા X	2 ધી X	3 ના	4 ધા 0	5 તી 0	6 ના	1 ધા X
--------------	--------------	---------	--------------	--------------	---------	--------------

પ્રકાર-

(1)	1 ધા X	2 ધી નાના	3 નાના	4 ધા 0	5 તી 0	6 નાના	1 ધા X
(2)	1 ધા-તિરક્ટિ X	2 ધીધી નાના	3 નાના	4 તા-તિરક્ટિ 0	5 ધીધી 0	6 નાના	1 ધા X

લગ્ની-

(1)	1 ધાગે X	2 તીના	3 કીના	4 તાકે 0	5 ધીના	6 ગીના	1 ધા X
(2)	1 ધાગે X	2 ધીના	3 તિરક્ટિ	4 તાકે 0	5 ધીના	6 તિરક્ટિ	1 ધા X

સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

- (1) તાલ કહરવાની સંપૂર્ણ જાણકારી આપો.
- (2) તાલ દાદરાની લગ્નીને લિપિબદ્ધ કરો.
- (3) તાલ-કહરવાના એક પ્રકારને લિપિબદ્ધ કરો.
- (4) તાલ-દાદરાની સંપૂર્ણ જાણકારી આપો.

2. સાચા જવાબ સામે ✓ ટીક કરો :

- (1) ઉપશાસ્ત્રીય સંગીતમાં કયો તાલ વગાડવામાં આવે છે ?

 (A) એકતાલ (B) અપતાલ (C) દાદરા (D) ચૌતાલ
- (2) શાસ્ત્રીય સંગીતમાં કયા તાલનો ઉપયોગ વધુ થાય છે ?

 (A) દાદરા (B) કહરવા (C) એકતાલ (D) દિપયંદી
- (3) કહરવા તાલમાં શું વગાડવામાં આવે છે ?

 (A) કાયદા (B) લગ્ની (C) તિહાઈ (D) પરન



પ્રસ્તાવના

તબલાના વિદ્યાર્થીઓને તબલાના વિવિધ વણોની જાણકારી હોવી અત્યંત જરૂરી છે. તબલા પર બધા જ વણો કઈ આંગળીથી કેવી રીતે વગાડવામાં આવે છે તેની જાણકારી વિદ્યાર્થી આ એકમ દ્વારા મેળવશે. તેમજ અંગળીઓના નામ જેવા કે તર્જની, મધ્યમમા, અનામિકા, કનિષ્ઠિકા, અંગુષ્ઠની જાણકારી પણ મેળવશે. દરેક બોલ તબલા પર અલગ અલગ આંગળીથી વગાડવામાં આવે છે એટલે આંગળીનું મહત્વ સમજાશે. વિવિધ બોલોની જાણકારી આ એકમ દ્વારા પ્રાપ્ત થશે.

(1) તા તિના કિટક તા.

- તા - તર્જની થી કિનાર ઉપર નીકળશે.
- તિ - તર્જની થી સ્યાહી ઉપર નીકળશે.
- ના - તર્જની થી કિનાર ઉપર નીકળશે.
- કિ - બાંધા ઉપર ખુલ્લા પંજાથી આધાત કરવાથી નીકળશે.
- ટ - મધ્યમા થી તબલા ઉપર સ્યાહી ઉપર નીકળશે.
- ત - તર્જની થી તબલા ઉપર સ્યાહી ઉપર નીકળશે.
- ક - બાંધા ઉપર ખુલ્લા પંજાથી આધાત કરવાથી નીકળશે.
- તા - તર્જની થી તબલાની કિનાર ઉપર નીકળશે.

(2) તીરકીટ તકતા તિરકીટ

- તી - તબલા ઉપર મધ્યમાથી સ્યાહી ઉપર આધાત કરવાથી નીકળશે.
- ૨ - તબલા ઉપર તર્જની થી સ્યાહી ઉપર આધાત કરવાથી નીકળશે
- કી - બાંધા ઉપર ખુલ્લા પંજાથી આધાત કરવાથી નીકળશે.
- ટ - તબલા ઉપર મધ્યમાથી સ્યાહી ઉપર આધાત કરવાથી નીકળશે.
- ત - તર્જની થી સ્યાહી ઉપર આધાત કરવાથી નીકળશે.
- ક - બાંધા ઉપર ખુલ્લા પંજાથી આધાત કરવાથી નીકળશે.
- તા - કિનાર ઉપર (તબલાની) તર્જની થી આધાત કરવાથી નીકળશે.

● તીરકીટ-ઉપર મુજબ રહેશે.**(3) નગધેત્રઘેટિત-**

- ન - તબલાની કિનાર ઉપર તર્જની થી આધાત કરવાથી નીકળશે
- ગ - બાંધા ઉપર મધ્યમા તથા અનામિકા દ્વારા આધાત કરવાથી નીકળશે.
- ધેતુ - તબલા ઉપર અંગૂઠા સિવાયની ચારે આંગળીઓનો સ્યાહી ઉપર આધાત કરવાનો તથા બાંધા ઉપર મધ્યમા અને અનામિકા દ્વારા નીકળશે.
- ધે - તર્જની થી સ્યાહી ઉપર આધાત કરવાથી તબલામાંથી ઉત્પન્ન જે બંધ અવાજ થાય છે તેને ‘ધે’ કહેવાશે.
- ટિ - તબલા ઉપર સ્યાહીના ભાગે મધ્યમા થી ઉત્પન્ન થશે.
- ત - તબલા ઉપર સ્યાહીના ભાગે તર્જની થી ઉત્પન્ન થશે.

(4) કડધેતીટ ધારોનિટ-

- ક - બાંયા ઉપર ખુલ્લા પંજાથી આધાત કરવાથી નીકળશે.
- ઢ - તબલા ઉપર સ્યાહીની કિનારે અનામિકા દ્વારા નીકળશે.
- ઘ - તબલા ઉપર તર્જનીથી સ્યાહી ઉપર આધાત કરવાથી ઉત્પન્ન થશે.
- તિ - તબલા ઉપર મધ્યમાથી સ્યાહી ઉપર આધાત કરવાથી ઉત્પન્ન થશે.
- ર - તબલા ઉપર તર્જનીથી સ્યાહી ઉપર આધાત કરવાથી ઉત્પન્ન થશે.
- ધા - તબલાની કિનાર ઉપર તર્જનીથી તથા બાંયા ઉપર મધ્યમા તથા અનામિકા દ્વારા સંયુક્ત રીતે વગાડતા ઉત્પન્ન થશે.
- ગે - બાંયા ઉપર મધ્યમાંનો આધાત દ્વારા નીકળશે.
- તિ - મધ્યમાથી તબલા ઉપર સ્યાહીનાં ભાગે આધાત કરવાથી ઉત્પન્ન થશે
- ર - તબલા ઉપર તર્જની થી સ્યાહી ઉપર આધાત કરવાથી ઉત્પન્ન થશે.

સ્વાધ્યાય

1. સાચા જવાબ સામે ✓ ટીક કરો :

- (1) “તા” શબ્દ કઈ આંગળીથી વગાડવામાં આવે છે ?
 - (A) મધ્યમ
 - (B) તર્જની
 - (C) અનામિકા
 - (D) કનિષ્ઠિકા
- (2) “તિ” શબ્દ તબલા પર કઈ જગ્યાએ વગાડવામાં આવે છે ?
 - (A) કિનાર
 - (B) લવ
 - (C) સ્યાહી
 - (D) મૈદાન
- (3) “ર” શબ્દ કઈ આંગળીથી વગાડવામાં આવે છે ?
 - (A) મધ્યમા
 - (B) તર્જની
 - (C) અનામિકા
 - (D) કનિષ્ઠિકા
- (4) “ક” શબ્દ કઈ આંગળીથી બાંયા પર વગાડવામાં આવે છે ?
 - (A) મધ્યમા
 - (B) તર્જની
 - (C) અનામિકા
 - (D) હાથનો પૂરો પંજો
- (5) “ડ” શબ્દ તબલા પર કઈ આંગળીથી વગાડવામાં આવે છે ?
 - (A) મધ્યમા
 - (B) તર્જની
 - (C) અનામિકા
 - (D) કનિષ્ઠિકા



પ્રસ્તાવના

સંગીતના વિદ્યાર્થીઓને વાદ્ય વિભાગમાં આવતા વાદ્યોની માહિતી આ એકમથી પ્રાપ્ત થશે. વાદ્યના પ્રકારો જેવા કે તત્ત્વ, વિત્ત, ધન, સુષિર, અવનધ— આ પ્રકારો પ્રમાણે દરેક વાદ્યને મૂકવામાં આવે છે અને વાદ્યોની જાણકારી મળશે. તત્ત્વ વિત્ત વાદ્યો એટલે કે તારથી અવાજ ઉત્પન્ન થતાં વાદ્યો અંતર્ગત આવતા ક્યા ક્યા વાદ્યો છે તેની જાણકારી પ્રાપ્ત થશે. એવી જ રીતે ધન વાદ્ય કેવી રીતે વાગે અને ક્યા ક્યા વાદ્યો આવે છે તેની માહિતી મેળવશે. એવી જ રીતે ફૂંકથી ઉત્પન્ન થતા સ્વર ક્યા વાદ્યમાંથી નીકળશે તેની જાણકારી મેળવશે. અને ચર્મથી મફેલ વાદ્યોના અવનધ પ્રકારમાં ક્યા વાદ્યો આવે છે તેની માહિતી આ એકમ દ્વારા પ્રાપ્ત થશે. આમ, ચારે પ્રકારના વાદ્યોની વિસ્તૃત માહિતી આ એકમ દ્વારા પ્રાપ્ત થશે.

આ એકમમાં વાદ્યના પ્રકારોની સાથે જે તે વાદ્યોમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરેલ કલાકારોના નામ પણ જાણવા મળશે જેથી વિદ્યાર્થીને વાદ્ય સાંભળતાં જ કલાકારોની સમજ પ્રાપ્ત થશે. વાદ્ય દ્વારા કલાકારોના યોગદાનની સમજ પ્રાપ્ત થશે. આમ, વાદ્ય વિભાગના વિદ્યાર્થીઓ વાદ્ય, વાદ્યના પ્રકાર અને વિવિધ કલા હસ્તગત કરનાર કલાકારોના નામની જાણકારી મેળવશે.

વાદ્ય વર્ગીકરણ :

ભારતીય વાદ્યોનાં પ્રકાર મુખ્યત્વે ચાર છે :

- | | |
|-----------------|----------------|
| (1) તત્ત્વવાદ્ય | (2) સુષિરવાદ્ય |
| (3) અવનધવાદ્ય | (4) ધનવાદ્ય |

તત્ત્વ-વિત્તવાદ્ય :

તત્ત્વવાદ્યો એટલે એવા વાદ્યો કે જે તારથી ધ્વનિ ઉત્પન્ન કરી શકતા હોય અથવા તો તાર વાળા વાદ્યોને તત્તવાદ્ય કહેવાશે. તથા વિત્તવાદ્યમાં ગજના સહારાથી નાદ ઉત્પન્ન થાય તેને વિત્તવાદ્ય કહેવાય છે.

ઉદા- સિતાર, સરોદ, તાનપૂરા, મેન્ડોલિન, સારંગી, વાયોલિન વગેરે.

સુષિરવાદ્ય :

એટલે એવા વાદ્યો જે ફૂંક મારવાથી અથવા તો હવાનાં દબાણથી વાગતા હોય.

ઉદા- વાંસળી, હાર્મોનિયમ, શહેનાઈ, મોરલી, શંખ, પાવો, બ્યુગલ માઉથઓર્ગન વગેરે.

અવનધવાદ્ય :

એટલે એવા વાદ્યો જેનો ઉપરનો કે બાજુનો ભાગ સપાટ હોય અને ચર્મથી મફેલા હોય.

ઉદા- તબલા-પખાવજ-ઢોલક, ઢોલ, નગારા, બોંગો, કોંગો, નાલ વગેરે.

ધનવાદ્ય :

બે હાથના આધાતથી ઉત્પન્ન થતા સ્વરવાદ્યને ધન વાદ્ય કહેવામાં આવે છે, જે ધાતુનાં બનેલાં હોય છે.

ઉદા- મંજુરા, ઝાંઝ, કરતાલ, કાષ્ટરંગ, જલતરંગ વગેરે.



વાદ્ય-વાદ્યકારો

પ્રસ્તાવના

સંગીતના વિદ્યાર્થીઓને વાદ્ય વિભાગમાં આવતા વાદ્યોની માહિતી આ એકમથી પ્રાપ્ત થશે. વાદ્યના પ્રકારો જેવા કે તત્ત્વ, વિત્ત્ત, ધન, સુષિર, અવનધ્ય— આ પ્રકારો પ્રમાણે દરેક વાદ્યને મૂકવામાં આવે છે અને વાદ્યોની જાણકારી મળશે. તત્ત્વ વિત્ત્ત વાદ્યો એટલે કે તારથી અવાજ ઉત્પન્ન થતાં વાદ્યો અંતર્ગત આવતા ક્યા ક્યા વાદ્યો છે તેની જાણકારી પ્રાપ્ત થશે. એવી જ રીતે ધન વાદ્ય કેવી રીતે વાગે અને ક્યા ક્યા વાદ્યો આવે છે તેની માહિતી મેળવશે. એવી જ રીતે ફૂંકથી ઉત્પન્ન થતા સ્વર ક્યા વાદ્યમાંથી નીકળશે તેની જાણકારી મેળવશે. અને ચર્મથી મફેલ વાદ્યોના અવનધ્ય પ્રકારમાં ક્યા વાદ્યો આવે છે તેની માહિતી આ એકમ દ્વારા પ્રાપ્ત થશે. આમ, ચારે પ્રકારના વાદ્યોની વિસ્તૃત માહિતી આ એકમ દ્વારા પ્રાપ્ત થશે.

આ એકમમાં વાદ્યના પ્રકારોની સાથે જે તે વાદ્યોમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરેલ કલાકારોના નામ પણ જાણવા મળશે. જેથી વિદ્યાર્થીને વાદ્ય સાંભળતાં જ કલાકારોની સમજ પ્રાપ્ત થશે. વાદ્ય દ્વારા કલાકારોના યોગદાનની સમજ પ્રાપ્ત થશે. આમ, વાદ્ય વિભાગના વિદ્યાર્થીઓ વાદ્ય, વાદ્યના પ્રકાર અને વિવિધ કલા હસ્તગત કરનાર કલાકારોના નામની જાણકારી મેળવશે.

તત્ત્વવાદ્ય

- | | |
|----------------|---|
| (1) સિતાર - | પં. રવિશંકર, પં. નિખિલ બેનર્જી, ઉ.વિલાયતખાં સાહેબ વગેરે |
| (2) સારંગી - | ઉ.સુલતાનખાંસાહેબ, પં. રામનારાયણજી |
| (3) વાયોલિન - | સુ. શ્રી. એન. રાજમ |
| (4) મોહનવીણા - | પં. વિશ્વમોહનભટ્ટ |

અવનધ્યવાદ્ય

- | | |
|------------|--|
| (1) તબલા | ઉ.થીરકવાખાંસાહેબ, ઉ.મુનીરખાંસાહેબ, અમીરહુસેનખાંસાહેબ, ઉ.જાકીરહુસેન,
પં. કિશનમહારાજ, પં. અનોખેલાલ, પં. સામતા પ્રસાદજી, પં. સુરેશ તલવળકર. |
| (2) પખાવજ- | પં. કુદરતસિહજી, પં. નાનાપાનસે, પં. લાલાભવાનીદાસજી |
| (3) ઢોલક- | ઉ.ખબેહુસેન ઢોલકિયા |
| ધનવાદ્ય- | એક સાથ સંગત માટે વપરાતું વાદ્ય બની રહે છે. આથી ધણાબધા કલાકારો ધનવાદ્ય વગાડતા હોય છે. |

● સુષિરવાદ્ય-

- | | |
|-------------|---|
| (1) વાંસળી- | પં. પન્નાલાલ ધોષ, પં. હરિપ્રસાદ ચોરસિયા, પં. રોનું મજમુદાર., પં. રઘુનાથ શેઠ |
| (2) શહેનાઈ- | ઉ.બિસ્મિલ્હાંખાન |

મુખ્ય કલાકારો

૧. જવાબ લખો :

- (1) ભારતીય વાદ્યોના પ્રકાર જણાવી તેને ઉદાહરણ સહિત જણાવો.
- (2) સુષિરવાદ્યનાં કોઈ પણ બે પ્રમુખ કલાકારોનાં નામ આપો.
- (3) અવનધ્યવાદ્યનાં બે પ્રમુખ કલાકારોનાં નામ આપો.
- (4) મોહનવીણાનાં વાદક કલાકારનું નામ આપો.

● ● ●